

॥ तस्य वाचकः पणवः ॥

# ऋत-भरा

आत्मनो हिताय जगातः सुखाय



‘योग’ लिखा लावीओ, ‘लिखु’ जनी गुरुद्वार;  
मुमुक्षु ज़र पामशे, सौनो मुजमां आग।

## \* ગૃહસ્થાશ્રમનો પુનરુદ્ધાર કરીએ \*

મંહિરો અને આશ્રમોનો પુનરુદ્ધાર કરવા કરતાં વધુ જરૂરત છે જીવતા-જીવતા ગૃહસ્થાશ્રમનો પુનરુદ્ધાર કરવાની કારણું કે આપણા સમજના ચારિત્રનો મુખ્ય આધાર છે ગૃહસ્થાશ્રમના ચારિત્ર ઉપર. ગૃહસ્થાશ્રમની હીવાળો ઉપર અમો, વહેમો અને યોગી લાલચે ઇથી ને લણે લાગેથી છે તેને સાચી સમજથુની આપિતદ્વારા ચૂનાના ફૂચડા દ્વારા તુરત જ આદે કરી નાખવાની સખત જરૂરત છે.

લોક-કલ્યાણ કરવાની ભાવનાવાળા ગુરુસંતોચો ગૃહસ્થાશ્રમીઓના સંપર્કોમાં રહેતું જોઈએ. અને તે માટે તેમણે ગૃહસ્થાશ્રમીઓના ત્યાં યોડા યોડા સમયે નિવાસ કરવો જોઈએ; તો લોકકલ્યાણનું મહા બાળપીરથ કાયં ખૂબ સરળતાથી અને ખૂબ અઠપથી સંપન્ન થઈ શકે.

— યોગબિશ્વ

૫. પ્ર. ગુરુદેવ શ્રી યોગબિશ્વજીએ ચાર માસ અમેરિકામાં રોકાઇને ઉપરોક્ત વિચારોનો ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો. તા. ૬-૬-૬૩ ના રોજ પૂજયથી સ્વનદેશ પદ્ધાર્યો છે.

## \* એમ્પ્રોપ્રિવારના કાર્યક્રમ \*

- (૧) એમ્પ્ર-ગુરુદેવ જયંતી : તા. ૯-૧૧-૬૩ મંગળવાર, સવારે ૪-૦૦ થી ૮-૦૦ ર/એ, અશોક એપાર્ટમેન્ટ, આંબાવાડી ચાર દસ્તા, આંબાવાડી, અમદાવાદ.
- (૨) બેભાતું વર્ષ : તા. ૧૪-૧૧-૬૩ રવિવાર, સવારે ૭-૦૦ થી ૮-૦૦ ર, ગંગાધર સોસાયટી, રામણાગ પાછળ, મહીનગર - ૩૮૦ ૦૦૮.
- (૩) દેવ દીવાળી : તા. ૫-૧૨-૬૩ રવિવાર, સવારે ૧૦-૦૦ થી ૩-૦૦ મહાદેવનગર સોસાયટીના મહાદેવમાં, ગોદન દ્વારાંગત સામે, સ્ટેલિયમ રોડ, નવરંગપુરા, અમદાવાદ.

# અસ્તમબરા

(અસ્તમબરા એટલે અનુભવયુક્ત સત્યથી ભરેલું)

(બહુજનહિતાચ - બહુજનસુખાચ)

(ત્રિમાસિક) આંકટો. - નાવે. - ડિસે.

VOL -III (93-94)

ISSUE-II

માનદ તંત્રી : નેષધ વ્યાસ

॥ ૩૦ ॥

## ચાલો ઉજવીએ - “કુતમબરા” દશાષ્ટી વર્ષ

‘કુતમબરા’ – ઓમ્ભુગુરુ પ્રેમસમર્પણધ્યાનભિન્ન પરિવાર દ્વારા પ્રગટ થતું ત્રિમાસિક સામાચિક છે.

કુતમબરા અર્થાત્ અનુભવયુક્ત સત્યથી ભરેલું ઓમ્ભુગુરુના આધિકારીઓએ અને ઓ.પ્રે.પ. ટ્રસ્ટના આધ્યાત્મિક વડા પ.પુ. ગુરુદેવ શ્રી યોગલિલુલાએ અણંગયોગની અતિ કઠિન સાધના કરેલી. પૂર્ણશ્રીની સાધનાનુભૂતિઓનો અને અનુભવેલાં સત્યોનો લાલ તેમના અંતરે જીવોને પ્રસંગોપાત્ર મળતો. અન્ય યોગસાધકો, કિજાસુઓ, આધ્યાત્મિકો ભાઈબહેનો વગેરે આ લાલથી વંચિત ના રહી જાય તેવો આગ્રહ ઓમ્ભુગુરુનાં સૌ ગુરુભૂઈબહેનોનો હતો.

આધ્યાત્મિક જ્ઞાનપિપાસુઓની જ્ઞાનશૂદ્ધ શાંત થાય, સામાન્ય જનસમાજ સારી સમજ્ઞાની પ્રાપ્તિ કરી અંગ્રેજીનાંથી સુક્ષ્મત મેળવે, ગૃહસ્થાયોર્મીઓ પોતાના ગૃહસ્થાયોર્મને સાચા અર્થમાં આશ્રમ જનાવી શકે, યોગસાધકો યોગ વિષેનું યોગ્ય માર્ગદર્શન મેળવે તે હેતુથી ઓ.પ્રે.પ. દ્રસ્તે જુલાઈ-૧૯૮૪ થી “પરિવારપત્રિકા” નામે એક સામાચિક પ્રગટ કરવાની શરૂઆત કરી. આ ત્રિમાસિકમાં પિરસાંતું સાહિત્ય એ તો પુ. ગુરુદેવનું અનુભવયુક્ત સત્ય હતું. તેથી જુલાઈ-૧૯૮૫થી આ ત્રિમાસિક સામાચિકનું નામ “કુતમબરા” રાજ્યામાં આવ્યું.

હેલ્લાં નવ વર્ષથી આ સામાચિકમાં પાતંજલ યોગદર્શન કથિત અણંગયોગ વિષેનું વિશેષ વર્ણન, વેણ-ઉપનિષદ ઉપરનું

તાત્ત્વિક ચિંતન-મનન, પુરાણ-શાસ્ત્રોની મૌલિક સમજ્ઞા, ઓમ્ભુગુરુના ઉપકે પ્રસંગોપાત્ર ક્રિજવાતા આધ્યાત્મિક શર્પકભોના પ્રેરણાદાયો અહેવાલ અને તે દરમાન પુ. ગુરુદેવ દ્વારા કર્યા તાત્ત્વિક-મૌલિક બહુજનસમાજોપયોગી પ્રવચનો પીરસવામાં આવે છે.

ઉપરોક્ત સાહિત્ય દ્વારા અનેક વાચકોએ, ગણ્યમાન્ય વક્તિત્વોને, સાધકોને, જિજ્ઞાસુઓને જે માણ કર્યું છે તે વાત અમે કહીએ તેના કરતાં તેમણે મોકલેલા અભિપ્રાયો અહીં રજૂ કરીએ તે વધુ યોગ્ય ગણ્યાય -

## “કુતમબરા”ને મળેલા અભિપ્રાયો

(૧) ગુરુબંદા શામાજાજ (અમરધામ, લાલ ગેભી આશ્રમ, હાથીજાળ.)

“કુતમબરા”નો અંક મળ્યો. આ અંક ગુરુપુર્જીમાં મહોત્સવ પ્રસંગે પ્રગટ થતો હોઈ પ્રસંગને અનુરૂપ લેખો વાંચો વિરોધ આનંદ, આધ્યાત્મિક, ધર્મિક અને સંતુષ્ટાદીના પ્રચાર અને પ્રસાર થતો સાહિત્યનું ઉત્તમ-મધ્યમ-કનિષ્ઠ વગેરે રીતે વર્ણન કર્યું હિતાવહ નથી કારણકે વ્યક્તિ તેની પ્રકૃતિ, સંસ્કાર અને અભિરૂચિ પ્રમાણે વર્ણિકરણ કરતી હોય છે તેથી તેમાં તત્ત્વથતા જગતાતી નથી. પરંતુ પોતાને જે ગમયું અને તે સર્વને આવકાર્ય હોય તેનો તત્ત્વ, નીડર, નિષ્પત્ત અને સત્ય અભિપ્રાય જરૂર આપી શકાય. આ અંકમાં છપાયેલ લેખોમાં પ્રવચનકારને કે સંકલનકારને, કોને ધન્યવાદ આપવા તેના દ્વિધામાં હતો. ધન્યવાદ બંનેને પરંતુ વિશેષ સંકલનકારને, કારણકે પ્રવચનમાં તો ઘણું બધું બોલાતું હોય છે. તેને સુધી, સુવ્યવસ્થિત અને વાચકની અભિરૂચિને ઘાનમાં રાપી, અસર કરે તેવું લખાણ આપવું તે તેની કુશાગ્ર બુદ્ધિને આભારી છે.

(૨) પ્રથમેશ પટેલ એમ.એસ.સી. (વલસાડ)

.....ॐ માંદી નિશ્ચળ, સ્વસ્તિક તથા બિન્દુના સ્વરૂપ વિષેની માહિતી અરેખર કલ્યાણકારી છે અને આશાવા યોગ્ય છે. આપે લખ્યું છે કે “સમસ્ત વિશ્વના સત્-સાહિત્યનું સંક્ષિપ્ત સ્વરૂપ એટલે અં અને આ અં નું સંક્ષિપ્ત સ્વરૂપ એટલે બિન્દુ આહ ! શું સનાતન સત્ય ! જે આજ સુધી કોઈ પણ જગ્યાએ વાંચવા કે સાંભળવા મળ્યું નથી. ખૂબ ખૂબ જ આનંદ અને સંતોષ થયો.

### (૩) દંતવૈદ લાભશંકર શુક્લ (રાજકોટ)

.....આપનું ભગવદ્ સાહિત્ય સમય લઈને અચૂક વાંચ્યું છું અને તેથી લાભ જ થાપ છે.

### (૪) માનવમુનિ (વિ-સર્જન આશ્રમ, નવલખા ઈન્ડોર, મ.ગ.)

“ચુટમ્ભરા” પત્રિકા જનવરી-કરવરી-માર્ચ ૧૯૭૧-૭૨ કી પછીં પઢી. પાઠકોં કે લિખે પ્રેરણાદાપક અને સાધકોં કે લિખે સાહાપક હે. લાભશાપક હે.

“ક્રસ્ટ, ક્રસ્ટીઓ અને આધ્યાત્મિક વડા” આપડા લેખ ચિન્તન-મનન કે લિખે સાધકોં કે લિખે પ્રેરણાદોત હે. ઉસે ગહરાની સે પર્દે, ચિન્તન વ મનન ડિયા જાયે તો ઉસમે સે નવનીત નિકલતા હે જો સાધકોં કે લિખે દિવ્ય જ્યોતિ સમાન હૈ.

### (૫) દલાભાઈ (તેલનાર)

“ચુટમ્ભરા”માં મંત્ર અને મંત્રોનાં રહસ્ય વિષે વાંચ્યું અને મુખોદ્ઘગાર નીકળી ગયો. અદ્ભુત ! અદ્ભુત !! સર્વ શાસ્ત્રોનો સાર અને મંથન બાદનું માખજા અને બક્તજનો માટે, કિજાસુઓ માટે અને બક્તિમાર્ગમાં પા પા પગલી કરનારાઓ માટે તો એક અમૂલ્ય વારસો છે, અમૂલ્ય ગ્રંથ છે. પત્રિકનાં પાણો સોણ છતાં વિગત હજાર, બે હજાર પાનાંની.

### (૬) જી. ગાંધી (પ્રાંગધ્રા)

અમારા સર્જનાન મુજબ તમોએ સૌરાષ્ટ્ર અપંગ મંડળ - પ્રાંગધારને વિના મૂલ્યે એક મોકલવાનું રાખ્યું છે તે ખૂબ ખૂબ આદરને પાત્ર છે. અમો એક વાંચી લીધા પછી આ એક સૌરાષ્ટ્ર અપંગ મંડળના પ્રમુખને આપવા જઈએ ત્યારે તેઓ અમારો તરફ લાગડીની નજરે જુઓ છે, અરેખર તો આપનો આભાર માને છે. નારદ-બક્તિ-સુરમાં લાખેલ છે કે “સા કસ્મે પરમ પ્રેમરૂપા આનંદસ્વરૂપા ય” એટલે તે શક્તિ ક્રાંથી પ્રેમરૂપે વરસે છે અથવા ક્રાંથી આનંદ સ્વરૂપ લાગે છે. આ તો હાથવગી શક્તિ છે. કૃપાશક્તિથી જ બધું

શક્ય છે ત્યારે હાથમાંથી “સરી જતી રમ્ય ધોખા” – ને પૂરેપણી માશાવા માટે અં પરિવારનું મુખ્યપત્ર (રુતમ્ભરા) કામ કરે છે. તે કાર્યથી સંતોષ થાપ છે અને કહેવા કરતાં – અન્યસ્માત, સૌલભ્ય બક્તી. જેનામાં કાયમી વિક્ષેપ-મળ છે તેણે આણંગયોગ સિદ્ધ નથી મેળવી. તે બધાંની વચ્ચે અન્ય રીતે બક્તિથી સિદ્ધ મેળવે એ કૃપાને કદાચ પક્કો-બળ મળો છે. એકબીજાના સાથી વચ્ચા પ્રેરણા મળી છે.

### (૭) મનુ પંડિત (સહતંત્રી-વિશ્વવાત્સલ્ય, અમદાવાદ)

પત્રિકાનું (“રુતમ્ભરા”નું) ટાઈટલ પણું આર્કેપ થયું છે. એમાં ગુરુદેવની જે મુદ્રા દેખાઈ છે તે જાણે કે મુમુક્ષુઓને જાર્થ્યગામી આરોહણનું નિશ્ચિત હુંગિત કરે છે; અને આત્માચિંદોને શાંતિનું આશ્વાસન આપે છે. આ બંને ભાવ એમાં નેત્રોમાં હું વાંચી શક્યો છું. જે લોકો શબ્દોની કડાકૂટમાં ન પડવા હુંચુતા હોય. તેમને માટે આટલી સ્નેહમુદ્રા જ પૂરતી છે. આવી સુંદર પત્રિકા પ્રગટ કરવા બદલ અમારા ધ્યાયાદ.

### (૮) ભાઈલાલભાઈ છાટબાર (ભાવનગર)

પત્રિકા ( રુતમ્ભરા ) સહુ સાધક બક્ત ભાઈ-બહેનોને સાંકળી રાખવા મદ્દદરૂપ થશે અને આજે જે બીજુ છે તે ભવિષ્યમાં શીતળ છાપા આપનારું વિશાળ વટવૃક્ષ બની રહેશે. આપનો પુરુષાર્થ પ્રશંસનીય છે.

### (૯) લક્ષ્મીપ્રેસાદ ના. સેવક (અમદાવાદ)

“રુતમ્ભરા”માં પૂ. ગુરુવર્ષ્ય યોગબિશ્બુદ્ધ ભારતીય સંસ્કૃતિના આધ વેદો, ઉપનિષદો, શ્રુતિ, સ્મૃતિ, ભગવદ્ગીતાના પ્રાખર અને નિગૃહ જ્ઞાનને મધુર સ્વાતિ બિન્દુઓની માફક સાદી, સરળ શૈલીમાં રજૂ કરી આપણાં મન અને બુદ્ધિને તેના આદ્ભુતાદક છંટકાવથી તુતા કરી રહ્યા છે, જેને આપનું મોદું સહ્ભાગ્ય ગણાવું રહ્યું. આ મંદ મંદ વહેતી જ્ઞાનસરિતામાં ઝૂભડી દઈ આપણાં અંતરનાં દાર ખોલવા પુનિત જ્ઞાન કરું જ રહ્યું. પત્રિકાના દિવ્ય સંપત્તિરૂપ જ્ઞાનને પચાવી અંતર્યેશુદ્ધો જૂલતાં પ્રકાશમય ઉદ્ઘાતન માર્ગ નિશ્ચિત સાંપડવાનો છે એવી અમારી શક્તા સરળ બની રહેલી.

### (૧૦) નવીન શાહ (સી.પી.એ. ન્યૂયોર્ક-અમેરિકા)

...આપનાં પ્રવચનો જ આજના માનવજીવનને દરિ બનશે અને એ દરિ જ માનવીને તેના જીવનસમુદ્રને તરવામાં સહાયરૂપ બનશે, જેણાયાતોનો સામનો કરવામાં આ નવીન

દરેક જ વાર્ષિક અનશે એમ હું માણું છું.

#### (૧૧) નંદુભાઈ (હરિ ઊં આગ્રહ)

આપના તરફથી પરિવાર-પત્રિકા (રૂતમ્ભરા)નો અંક માટ્યો. પાંચ્યો. રાણ્યો. આપનો ચાંદો આભાર.

#### (૧૨) ગીતા જૈન (તંત્રી-પર્વ પ્રશ્ના, મુંબઈ)

"રૂતમ્ભરા" ખૂબ સુદૂર નામ છે. ચરમ સીમા પ્રાપ્ત કરી લે એ જ "સત્ય" એ અંકમાં પ્રગટ થતું હશે.

#### (૧૩) હેમંત મહેતા (અમદાવાદ)

"પ્રથમ બક્ઝિત સંતન કર સંગા." નવધા બક્ઝિતમાં સૌ પ્રથમ સંત-સંગ, સત્સંગ કરવાનું કહું છે. અને આ એક બક્ઝિત આવે તો પછી નવે નવ બક્ઝિત આપોઆપ આવે. પરંતુ આજના કણિકુગમાં સત્સંગ કરવાનો સમય લોડો પાસે છે નહીં અને જેનો પાસે સમય છે તેઓ સત્સંગ કરી શકતા નથી અને જેઓ સત્સંગ કરે છે તેઓ મોટા બાગે સાચા સંતનો સમાગમ નથી કરતા હોતા. સાચા સંત મળવા મુશ્કેલ છે. ગીતામાં કહું છે - અભિનો માણસોમાં એક સાચો ભક્ત, સાચો સંત હોય છે; જ્યારે આજકાલ તો સંતોનો રાફડો કાટવો છે. આવા સમયે "રૂતમ્ભરા" સાચા અર્થમાં સત્સંગ કરાવે છે.



જુલાઈ-૧૯૭૮ થી જુન-૧૯૭૯ સુધીનું વર્ષ "રૂતમ્ભરા" દર્શાબ્દી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. તે નિમિત્ત ઓ.પ્રે.પ. ટ્રસ્ટ દ્વારા અનેક ગામડાંઓમાં અને શહેરોમાં આચાર્યાત્મિક અર્થક્રમો યોજવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ અર્થક્રમ

દરમ્યાન ઓમ્ભૂપરિવારના સ્વયંસેવકો ખ.પૂ. ગુરુદેવ શ્રી યોગભિકુણા તાન્ત્રિક-મૌલિક વિચારોને બહુજનસમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે; તેના દ્વારા અનેક વ્યક્તિઓને સાચી સમજા પ્રાપ્ત કરાવવાનો મુક્ત કરાવવાનો પ્રયત્ન કરશે.

### નમ્ર વિનંતી

આપને આગ્રહબરી નમ્ર વિનંતી કે આપ સૌ પદ્ધ બહુજનહિતાય-બહુજનસુખાયના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનો. આ દર્શાબ્દી વર્ષ નિમિત્ત "રૂતમ્ભરા" સામયિકના આજીવન સભ્ય બની-બનાવી તેમાં પિરસાતા અમૂલ્ય સાહિત્યના પ્રચાર-પ્રસારમાં મદદરૂપ થાઓ. અસ્તુ,

"રૂતમ્ભરા" - "રજિસ્ટ્રાર ઓફ ન્યૂજ પેપર્સ ઓફ ઇન્ડિયા - અન્ડર રજિસ્ટર્ડ નંબર ૪૮૭૭૦/૮૦" દ્વારા નોંધકો પામેલ ત્રિમાસિક સામયિક છે, જેની આજીવન સભ્ય કી રૂ.૨૫૦/- છે. તા. ૧-૬-૮૮ થી તા. ૩૦-૬-૮૪ સુધીમાં આજીવન સભ્ય બનનારને - "મુક્તા" (પાતંજલ યોગદર્શન-સમાધિપાદ), "પ્રેરણાસિંહ્ય" (તહેવારોની મૌલિક સમજ), "પૂજ્યબ્રતીમાં ઈશ્વરદર્શન" (૫. ગુરુદેવ શ્રી યોગભિકુણા દક્ષિણાભારત અને અમેરિકાની યાત્રાનું વર્ણન) અને "ઓમ્ભૂપરિવાર" નામનાં પુસ્તકો મેટ આપવામાં આવશે.

"રૂતમ્ભરા" પ્રકાશન સમિતિ

## શાંતિ

(પાતંજલ યોગદર્શન - સાધનપાદ)

-યોગભિકુણ

તથ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાણિપાનને ડિયાયોગ કહે છે. ડિયાયોગ સમાધિની પ્રાપ્તિ માટે અને કલેશોને તનુ કરવા માટે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દેષ અને અભિનિવેશ આ પાંચ નામવાળા પાંચ પ્રકારના કલેશો છે. આ પાંચ કલેશોને ગ્રસુમ, તનુ, વિચિન અને ઉદાર નામવાળી ચાર

અવસ્થાઓ છે અને તેમનું કોત્ર અવિદ્યા છે. અવિદ્યારૂપી કેન્દ્રમાં-ભેતરમાં આ કલેશો ઉગ્ની નીકળે છે.

ઉપરોક્ત વાતોને ગયા અંકમાં ખૂબ વિસ્તારપૂર્વક સમજાવા. હવે પાંચ પ્રકારના કલેશોને સમજાયે.

અનિત્યાશુદ્ધિદુખાનાત્મસુ નિત્યશુદ્ધિ  
સુખાત્મભ્યાતિરવિદ્યા ॥૫॥

**ભાવાર્થ :** અનિત્યમાં નિત્ય જ્ઞાનાં, અપવિત્રમાં પવિત્ર જ્ઞાનાં, દુઃખમાં સુખ જ્ઞાનાં અને જરૂરમાં ચેતન જ્ઞાનાં તેને અવિદ્યા કહેવામાં આવે છે.

**વિસ્તાર :** આપણામાં જે ખોટું જ્ઞાન પ્રવર્તે છે, મિથ્યા જ્ઞાન પ્રવર્તે છે, ખોટી માન્યતાઓ અને બ્રહ્મજ્ઞાનો પ્રવર્તે છે તેને અવિદ્યા કહેવામાં આવે છે. તે અવિદ્યાના ચાર બાગ છે, ચાર રીતે તે વ્યાપેલી છે. આ ચારેય પ્રકાર મળોને તેનું સામુહિક નામ છે, અવિદ્યા. ચાર પ્રકાર કયા કયા?

(૧) અનિત્યમાં નિત્ય જ્ઞાનાં. જે અનિત્ય છે તેને આપણે નિત્ય સમજી બેઠા છીએ. અનિત્ય એટલે કે જે નિત્ય રહેવાવાનું નથી. આપણું આ પંચમલાભૂતનું શરીર, તેમાંના ઈન્દ્રિયો; તે જ પ્રમાણે આપણાં વધાલાં કુટુંબીજનોનાં શરીરો, સગાં-સંબંધો, મિત્રમંડળનાં શરીરો; તેનાથી આગળ વધતાં તમામ જીવોનાં શરીરો, સમસ્ત જગતમાં જે કાઈ ભૂતાત્મક વસ્તુઓ વ્યાપેલી છે તે સર્વે કેવી છે? અનિત્ય કાણે કાણે તેનો નાશ થઈ રહ્યો છે. આવી તમામ અનિત્ય વસ્તુઓને આપણે અવિદ્યાના કારણે નિત્ય સમજી બેઠા છીએ.

(૨) અપવિત્રમાં પવિત્ર જ્ઞાનાં. શુદ્ધિ એટલે પવિત્ર અને અશુદ્ધિ એટલે અપવિત્ર. જે જે પદાર્થો અપવિત્ર છે તેને આપણે મહાન પવિત્ર ગણી રહ્યા છીએ, પવિત્ર સમજ રહ્યા છીએ. આ પ્રકારની અવિદ્યાના કારણે જે તિરસ્કાર ઉત્પત્ત કરે તેવી અને ગંદકીવાળી જગ્યાઓ છે તેમાં જ આપણે રચ્યાપચ્યા છીએ; તેવી જગ્યાઓને આપણે મહાન પવિત્ર ગણીએ છીએ અને તેમાં જ મોજમજ માણીએ છીએ.

(૩) દુઃખમાં સુખ દેખાનાં. જે ભયંકર દુઃખો જ છે, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણો ડાળમાં દુઃખરૂપે જ છે; આપણાને જે દુઃખી જ કરે છે તેવી સમસ્યાઓને, તેવા પદાર્થોને, તેવાં પ્રકરણોને આપણે સુખમય માની રહ્યા

છીએ. સામાન્ય મનુષ્યોને જે સુખ, સુખ લાગે છે તે સુખ વિવેકીજનોને દુઃખ લાગે છે. તે એટલે માટે કે તેવાં બધા સુખો તાત્ત્વિક રીતે જોતાં પરિશામ-દુઃખ, તાપ-દુઃખ અને સંસ્કાર-દુઃખ છે. આ નજી રીતે જોતાં જે સુખો વિવેકીજનોને દુઃખ લાગે છે તેને સામાન્ય મનુષ્યો સુખ સમજ બેઠા છે. આ રીતે આપણે પણ તેને સુખ સમજ બેઠા છીએ. ખોટી માન્યતાઓ કે જે દુઃખમય જ છે તેને સુખમય સમજ બેઠા છીએ.

(૪) અનાત્મમાં આત્મપણું જ્ઞાનાં. અનાત્મમાં આત્મપણું એટલે જરૂર ચેતન જ્ઞાનાં. તેના માટે આપણા શરીરનું દાઢાંત લઈએ. આપણું શરીર તો જરૂર છે, અનાત્મા છે; તેને આપણે આત્મા સમજ બેઠા છીએ, ચેતન સમજ બેઠા છીએ. આ ચોથા પ્રકારની ખોટી માન્યતા.

ઉપરોક્ત ચારેય માન્યતા તે અવિદ્યાનાં રૂપ છે, તેનું જ નામ અવિદ્યા. આ અવિદ્યા જ બીજા નખા કલેશોનું કોગ છે. જો આ અવિદ્યા ના હોય તો કલેશો ઊરી જ ના શકે, ટકી જ ના શકે, રહે જ નહીં, તેથી પ્રથમ તો અવિદ્યાને સમજાવવામાં આવી. હવે સમજાવે છે અસ્મિતા.

દગર્દર્શનશક્તિઓરેકાત્મતેવાઅસ્મિતા ॥ ૬ ॥

**ભાવાર્થ :** દગર્દર્શિત અને દર્શનશક્તિને એક સમજવી તેનું નામ અસ્મિતા નામનો કલેશ છે. દગ એટલે જોનાંએ આત્મા અને દર્શન એટલે જેના વડે જોનાંએ જુબે છે તે ઈન્દ્રિયો. ઈન્દ્રિયો દ્વારા તે જગતને જુબે છે તે તેનો જોવાની શક્તિ - ઈન્દ્રિયોની શક્તિ - અને આત્માની શક્તિને એક સમજવી, એટલે કે આત્મા અને ઈન્દ્રિયોને એક સમજવાં તે અસ્મિતા નામનો કલેશ છે.

સુખાનુશયી રાગ: ॥ ૭ ॥

**ભાવાર્થ :** સુખની પાછળ જનારો રાગ (૭).

**વિસ્તાર :** રાગ કલેશ કોને કહેવામાં આવે છે? આપણે એક સુખ બોગવીએ છીએ તે સુખની ગેરાલાજરીમાં કરીકરીને તેની યાદ ઓપણને આવ્યા કરે છે; સુખના સંસ્કારોને તે કલેશ પાછળ છોડતો જાય છે અને તેથી તે સુખની યાદ આવ્યા કરે છે, તે સુખની યાદ સતીન્યા કરે છે. આમ સુખની પાછળ જનારા કલેશને રાગ કરે છે.

દા.ત. આપણે અમુક સ્થળે ભજિયાં ખાયાં. આપણને ખૂબ લાયાં અને તેથી ભજિયાં ખાવાનું સુખ પ્રાપ્ત કર્યું. પરંતુ દરરોજ તો તે સ્થળે આપણે જઈ શકતા નથી અને ભજિયાં ખાઈ શકતા નથી; અને ભજિયાંની યાદ તો આપણને સતત સતતાથ્યા કરે છે. તો એ થયો રાગ નામનો કહેશ.

હૃદાનુશથી દેખ: ॥ ૮ ॥

**ભાવાર્થ :** હૃદાની પાછળ જનારો દેખ (છ).

**વિસ્તાર :** આપણને જે કાઈ હૃદાનું હોય છે તે ગાલ્યા ગયા પછી પણ પોતાના સંસ્કારોને પાછળ છોડતું જાય છે. એ હૃદાનું તરફ તિરસ્કારનો ભાવ ઉત્પત્ત થાય છે. જ્યારે જ્યારે તે હૃદાનું આપણને યાદ આવે ત્યારે તેના તરફ તિરસ્કારની વૃત્તિ ઉત્પત્ત થાય છે. તેનું નામ દેખ; તેને દેખ નામનો કહેશ કરે છે.

સ્વરસવાહી વિદુધોઅપિ તથા રૂઢોઅભિનિવેશ: ॥ ૯ ॥

**ભાવાર્થ :** જે સ્વાભાવિક રીતે જ (શરીરની) સાથે આવે છે અને વિદ્ધાનો ઉપર પણ સવાર થઈને રહે છે તે અભિનિવેશ (કહેશ છે).

**વિસ્તાર :** અભિનિવેશ નામનો આ પાંચમો કહેશ છે. અભિનિવેશ કહેશ કોને કહેવામાં આવે છે? મૃત્યુના ભયને અભિનિવેશ કહેશ કહેવામાં આવે છે.

**સ્વરસવાહી** = અનેક જન્મોથી આપણી સાથે તે વહી રહ્યો છે અને વિદુધોઅપિ = જેવી રીતે મૂર્ખાઓ ઉપર ચઢી બેઠો છે તેવી જ રીતે વિદ્ધાનો ઉપર પણ ચઢી બેઠો છે. એટલે કે મૂર્ખ અને અભિનિવિદ્ધાનો તેનાથી જેટલા ડરે છે તેટલા જ મહાવિદ્ધાનો અને મહાત્માઓને પણ તેનાથી ડરે છે. મૃત્યુભૂતિની તે અભિનિવેશ કહેશ અનેક જન્મોથી આપણી સાથે સાથે વહી રહ્યો છે, એટલે કે સાથે આવી રહ્યો છે. મૃત્યુ મૂર્ખ લોકોને જેટલું ડરાવે છે તેટલું જ વિદ્ધાનો અને મહાત્માઓને પણ ડરાવે છે અને એ ડર, એ મૃત્યુનો ભય સતત આપણી સાથે અનેક જન્મોથી આવી રહ્યો છે. આ મૃત્યુભૂતિની આપણે પૂર્વજન્મની પણ સાભિતી કરી શકીએ છીએ. તે આ રીતે -

આપણને મૃત્યુનો ભય કેમ લાગી રહ્યો છે? આપણે

આપણા જીવનમાં જેનો જેનો, જે જે હૃદાનો અનુભવ લીધો હોય તે હૃદાને આપણી સામે આવે ત્યારે તેનો આપણને ભય લાગે તે સ્વાભાવિક છે.

નિયમ તો એ કહે છે કે આપણે આપણા જીવનમાં જે જે હૃદાનો, જે જે ત્રાસનો અનુભવ કર્યો હોય - સ્વાનુભવ લીધો હોય તે હૃદાયક વિષય કે પ્રસંગ આપણી સામે આવવા લાગે ત્યારે આપણે તેનાથી ડરીએ છીએ કારણકે તેનો આપણે સ્વાનુભવ કર્યો હતો. તે વાતને એક દિનાંતથી સમજીએ.

એક દીવો કે એક મીંથાબતી સણગી રહી છે. તેની પાસે એક નાનું બાળક બેહું છે. તેણે હજુ અગ્રિથી દાઝવાના ભયનો અનુભવ નથી કર્યો તેથી તે મીંથાબતીને પકડવાનો પ્રયત્ન કરે છે. તે મીંથાબતીની જ્યોત તેને રમકડું લાગે છે, રમવાની ચીજ લાગે છે. તેથી તે તેની સાથે રમવાનો પ્રયત્ન કરે છે. કેમકે હજુ તે કચારેય અગ્રિથી દાઝયું નથી તેથી અગ્રિથી દાઝવાનું જે હૃદા છે તેનો હજુ તેણે સ્વાનુભવ કર્યો નથી તેથી તેને તે પકડવાનો પ્રયત્ન કરે છે અને જેવો હાથ નાખ્યો તેવું તે દાઝયું અને બૂમ પાડી ઊઠ્યું. હવે ફરીને તે તેને પકડવાનો પ્રયત્ન નહીં કરે. પહેલાં તો આપણે તેને રોકતા હતા. પણ આપણી નજરસૂક્ષ્મ થઈ ગઈ અને તેણે જ્યોત પકડી અને તેથી તે દાઝયું. તેને બધંકર હૃદાથિયું. હવે તે મીંથાબતીની પાસે ના જાય. હવે ફરીને તેનો હાથ પકડીને મીંથાબતી પાસે લઈ જવાનો પ્રયત્ન કરીએ તો પણ તે હાથને જબરાજસ્તીથી પાણો નેંબી લેશે. કેમ કે તેને હવે સ્વાનુભવ થયો કે આ જ્યોતથી દાઝાય છે અને મહાદુઃખ થાય છે. તેથી તેની પાસે ના જવાય. તેને પકડીએ તો હૃદા થાય. પહેલાં તો તેને તેનો સ્વાનુભવ નહોતો એટલે અગ્રિનો સ્પર્શ કર્યો અને હૃદા વહેરી લીધું. હવે સ્વાનુભવ થયો તેથી તે, તે હૃદા પાસે ના જાય.

તો, આ સિદ્ધાંતથી એ તારવળી નીકળી કે હૃદાનો સ્વાનુભવ થયા પછી તે હૃદા પાસે આપણે જતા નથી, તેનાથી છેટા રહીએ છીએ. પરંતુ જ્યાં સુધી તે હૃદાનો અનુભવ નથી ત્યાં સુધી તો તે હૃદાની પાસે આપણી જઈએ

છીએ. તે હુંખનો ભય ક્યારે લાગે કે જ્યારે તેનો સ્વાનુભવ થાય.

આપણને ચાલુ છુવનમાં મૃત્યુનો ભય લાગે છે. આ સૂત્રમાં આવ્યું કે મૂર્ખાઓ અને વિદ્ધાનો બધાને મૃત્યુનો ભય લાગે છે. તો એ મૃત્યુનો ભય કેમ લાગે છે? આ છુવનમાં આપણે મૃત્યુનો સ્વાનુભવ લીધો છે? ના, આ છુવનમાં તો મૃત્યુનો સ્વાનુભવ નથી લીધો. સિદ્ધાંતમાં તો રજૂઆત થઈ કે એક વખત હુંખનો સ્વાનુભવ, ભયનો સ્વાનુભવ લઈએ ત્યાર પછી જ તેનો ભય લાગે છે, ત્યાર પહેલાં નહીં. તો, આ છુવનમાં તો આપણે મૃત્યુનો અનુભવ લીધો નથી. તો કેમ મૃત્યુથી આપણે ડરી રહ્યા છીએ? મૃત્યુનો ભય આપણને કેમ સત્તાવી રહ્યો છે? અભિનિવેશ કલેશ આપણને કેમ હુણી કરી રહ્યો છે? મૃત્યુથી ભય પામી રહ્યા છીએ પરંતુ આ છુવનમાં તો મૃત્યુનો સ્વાનુભવ લીધો નથી.

તો, આનાથી એ સાબિત થયું કે જો આપણે વર્તમાન છુવનમાં મૃત્યુના ભયનું હુંખ અનુભવ્યું નથી અને છતાં આપણને તે હુંખનો ભય લાગી રહ્યો છે તો, બલે આ છુવનમાં નહીં પરંતુ ક્યારેક પણ આપણે મૃત્યુનો સ્વાનુભવ લીધેલો છે, મૃત્યુના ભયનું હુંખ આપણે અનુભવેલું છે તેથી આપણે આ છુવનમાં તેનાથી ડરી રહ્યા છીએ. વર્તમાન છુવનમાં બલે મર્યાદા નથી, મૃત્યુનો અનુભવ બલે લીધો નથી પણ ગમે ત્યારે આપણને તે મૃત્યુનો અનુભવ થયો છે તે નિશ્ચિત છે. અને જો મૃત્યુનો અનુભવ લીધો છે તો મૃત્યુ તો કોનું હોઈ શકે? મૃત્યુ શરીરનું હોઈ શકે. શરીર ત્યારે હોઈ શકે કે જ્યારે તેનો જન્મ થયેલો હોય. તો ક્યારેક પણ તે શરીરનો જન્મ થયેલો હોય, અને તેથી વર્તમાન સિવાય પણ આગળનો આપણો હોઈ જન્મ હશે. તો, આ રીતે આપણો પૂર્વજન્મ હશે.

તો આમ, અભિનિવેશ કલેશથી આપણે પૂર્વજન્મની સાબિતી કરી કે આ વર્તમાન જન્મ પૂર્વ પણ આપણા અનેક જન્મો હોઈ શકે. આમ અભિનિવેશ કલેશથી ચોક્કસપણે પૂર્વજન્મને સિદ્ધ કર્યો કે પૂર્વજન્મ છે જ. પૂર્વજન્મમાં ના માનતા હોય તેમના માટે આ સૂત્ર અતિ

ઉપયોગી છે. આ સૂત્ર અતિશય ઉપકારક છે - પૂર્વજન્મની સિદ્ધિ માટે; કે પૂર્વજન્મને ન માનતા હોય તેમના માટે. અને જો વર્તમાન જન્મ પૂર્વ પણ જન્મ હોઈ શકે તો વર્તમાન જન્મ પછી પણ જન્મ (પુનર્જન્મ) હોઈ શકે જ. આ રીતે અભિનિવેશ કલેશથી પૂર્વજન્મ અને પુનર્જન્મ બને ચોક્કસપણે સાબિત થઈ શકે છે.

આ રીતે આપણે અવિદ્યા, અસ્મિતા, રાગ, દેખ અને અભિનિવેશ નામના પાંચ કલેશોને સમજ્યા.

તે પ્રતિપ્રસવહેયા: સૂક્ષ્મા: ॥ ૧૦ ॥

ભાવાર્થ : સૂક્ષ્મ થયેલા તે કલેશોને તેની જન્મભૂમિ (કારણભૂમિ)માં પછોંચાડી દેવા.

વિસ્તાર : ઉપરોક્ત પાંચેય કલેશોને પ્રતિપ્રસવ કરી નાખવા જોઈએ, એટલે કે તેને તેની જન્મભૂમિમાં પછોંચાડી દેવા જોઈએ, જો તે કલેશોથી આપણે મુક્ત થવું હોય તો. હેઠાં: એટલે કે તેને નાટ કરી નાખવા જોઈએ, જે આપણી શાંતિને ઉધોળી રહ્યા છે, નાટ કરી રહ્યા છે તેમને નાટ કરી નાખવા જોઈએ, તેમને હટાવી દેવા જોઈએ. કઈ રીતે? સૂક્ષ્મ કરીને. તે પાંચેય કલેશોને સૂક્ષ્મ કરીને “પ્રતિપ્રસવ” એટલે કે તેની જન્મભૂમિમાં પછોંચાડી દેવા જોઈએ. સૂક્ષ્મ કર્યી રીતે કરવા? ડિયાપોગથી. તેના માટે પહેલાં અને બીજા સૂત્રમાં સૂચના છે.

કલેશોને તનુ કરવા માટે શું કહ્યું? ડિયાપોગ; તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાણનરૂપી ડિયાપોગ દ્વારા કલેશોને તનુ કરી નાખવા. આ દરમા સૂત્રમાં પણ કહ્યું કલેશોને પ્રતિપ્રસવ કરી નાખવા. પ્રતિપ્રસવ કરવા માટે તેને સૂક્ષ્મ કરી નાખવા જોઈએ. કલેશોને સૂક્ષ્મ કરીને જ તેનો પ્રતિપ્રસવ થઈ શકે. સૂક્ષ્મ કરીને તેમને તેમની જન્મભૂમિમાં પછોંચાડી દેવા.

ડિયાપોગથી કલેશોને સૂક્ષ્મ કરીને તેમની જન્મભૂમિમાં, તેમની કારણભૂમિમાં તો પછોંચાડી દીધા. પરંતુ પછી તેમની જન્મભૂમિમાંથી પણ તે પાછા ન જન્મે તેટલા માટે તેમની જન્મભૂમિમાંથી પણ તેમનો નાશ કરી નાખવો જોઈએ. તો, તેમની જન્મભૂમિમાંથી પણ તેમનો નાશ કરી નાખવા માટે શું સાધન જતાવ્યું? ધ્યાન.

## ધ્યાનહેયાસલદવૃત્તયઃ ॥ ૧૧ ॥

**ભાવાર્થ :** તે કલેશવૃત્તિઓનો નાશ 'ધ્યાન'થી કરવો.

**વિસ્તાર :** ધ્યાનની ઘડી મોટી ઉપરોગિતા છે. કિયાયોગથી ઉપરોક્ત પાંચેય કલેશોને સૂક્ષ્મ તો કરી નાખ્યા, સૂક્ષ્મ કરીને તેમની જન્મબૂભૂમિમાં પહોંચાડી દીધા, સૂક્ષ્મ કર્યા સિવાય તેમને તેમની જન્મબૂભૂમિમાં ન પહોંચાડી શકાય તે વાતને એક સ્થળ દાણંતરી સમજું.

એક પેટીમાં ઘડાં કપડાં બર્યા છે. સુંદર વ્યવસ્થિત ગરી કરીને તેમાં કપડાં બર્યા છે. પેટી પૂર્ણ બરેલી છે. તે પેટીને ખોલી કપડાને બદાર કાઢી નાખીએ અને તેની ગરી ખોલી નાખીએ તો એક મોટો ઢગલો થાય. પછી તે બધાં કપડાને વ્યવસ્થિત ગરી કર્યા સિવાય જ એટલે કે સૂક્ષ્મ કર્યા સિવાય (આ જગ્યાએ વ્યવસ્થિત ગરી કરવી એટલે વ્યવસ્થિત રીતે સૂક્ષ્મ કરવાં) અવ્યવસ્થિત ગરીમાં, ફુલેલાં હતાં તેમજ પેટીમાં બરી દઈએ તો તે પેટીમાં ના માય. તે પેટીમાં મવડાવવા માટે, તે પેટીમાં સમાવવા માટે, તે પેટીમાંથી કાઢતી વખતે તે કપડાંની જેવી સૂક્ષ્મ ગરી હતી તેવી ગરી કરીને સૂક્ષ્મ કરી નાખવાં (સંકેલવાં) પડે. તો તે પેટીમાં પાછાં સમાઈ શકે. પેટીમાંથી કાઢવા પછી તેમની ગરી ખૂલી ગઈ અને તે વિસ્તૃત થઈ ગયાં. તેથી તે વિસ્તૃત અવસ્થામાં પેટીમાં પાછાં સમાઈ ના શકે. તે પેટીમાં તેમને સમાવવા માટે તો કાઢતી વખતે જેવાં વ્યવસ્થિત હતાં એવાં કરવાં પડે. આમ, તે કલેશો તેમની જન્મબૂભૂમિમાંથી જન્મતી વખતે જેટલા સૂક્ષ્મ હતા, અત્યારે તેટલા અને તેવા સૂક્ષ્મ તે રહી શક્યા નથી. અત્યારે તો તે અતિ વિસ્તૃત થઈ ગયા છે, ઘડા વિશ્વાણ થઈ ગયા છે; તેથી તે સ્થૂળતામાંથી, તે વિસ્તૃતતામાંથી તેમને કરીને પાછા તેટલા સૂક્ષ્મ બનાવવા જોઈએ. કિયાયોગથી સૂક્ષ્મ કરીને પછી તેમને તેમની જન્મબૂભૂમિમાં પહોંચાડી શકાય.

હવે સૂક્ષ્મ બનાવીને જન્મબૂભૂમિમાં તો પહોંચાડી દીધા. પરંતુ તે તેમની જન્મબૂભૂમિમાંથી કરીને પાછા નહીં જન્મે તેની શી ખાતરી ? પહેલાં જન્મ્યા જ હતા ને ! આપણે તેમને સૂક્ષ્મ બનાવીને તેમની જન્મબૂભૂમિમાં પહોંચાડી દેવા પડ્યા કેમ કે તે જન્મ્યા ચૂકેલા હતા, એટલે પહેલાં પણ

જન્મ્યા હતા, તો હવે પછી નહીં જન્મે તેની શી ખાતરી ? જન્મબૂભૂમિમાં તો પહોંચી ગયા પરંતુ હજુ તાં સૂક્ષ્મરૂપે, બીજરૂપે તો પહેલા જ છે. જે કાંઈ બીજરૂપે પહેલું છે તેને અનુકૂળ વાતાવરણ મળે તો તે કરીને જન્મ્યે તેની આપણાને ખાતરી તો છે નહીં. જો તે કરીને જન્મે તો આપણી બધી મહેનત પાણી થઈ જાય, તેથી, કરીને તે ત્યાંથી ના જન્મે તેના માટે શું કરવું જોઈએ ? તેમને ત્યાંથી પણ નાચ કરી નાખવા જોઈએ. ત્યાંથી નાચ કરી નાખવા માટે શું સાધન બતાવ્યું છે ? "ધ્યાન". ધ્યાન દ્વારા કલેશોને તેમની જન્મબૂભૂમિમાંથી પણ નાચ કરી શકાય છે. ધ્યાન સિવાય તે સૂક્ષ્મ અવસ્થામાં પોતાની જન્મબૂભૂમિમાં પડ્યા રહે છે. તેમને જન્મબૂભૂમિમાં પહોંચાડ્યા પછી ધ્યાનનો ખૂબ અભ્યાસ કરવો પડે અને ધ્યાનના અધ્યાત્મિક તેમનો તેમની જન્મબૂભૂમિમાંથી પણ નાશ કરી નાખવાં કે જેથી તે કરી કદી પણ જન્મ્યે જ ના શકે. એ દુઃખબીજ થઈ ગયા. જેમકે બાજરો કે જુવાર આપણે પેતરમાં વાવીએ છીએ તો તે ઊગી નીકળે છે. પરંતુ જે તેમને શેડીને વાવાં હોય તો ? અધ્યાત્મમાં ખૂબ શેડી નાખ્યા પછી તેમને વાવીએ તો પછી તે ઊગી શકતાં નથી. તો, જન્મબૂભૂમિમાં પહેલા હતા તે કલેશોને ધ્યાન દ્વારા શેડી નાખવાના એટલે કરીને તે ઊગી જ ના શકે. તો, ધ્યાનના અભ્યાસથી ઉત્પત્ત અધ્ય દ્વારા જો તે કલેશોને બાળી નાખવામાં ના આવે તો તે પોતાની જન્મબૂભૂમિમાં સૂક્ષ્મ અવસ્થામાં અનંત કાળ સુધી પડ્યા રહે છે, અને અનુકૂળતા મળતાં કારણબૂભૂમિમાંથી કાર્યબૂભૂમિમાં અવતરિત થઈને સમય જતાં મહાબળવાન થઈ જાય છે.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા તેમને સૂક્ષ્મ તો બનાવી નાખ્યા. પરંતુ તેમને સૂક્ષ્મ બનાવીને તેમની જન્મબૂભૂમિમાં પહોંચાડી દીધા પછી તેના ઉપર પ્રાણાયામ ઈત્યાદિ બદારનાં અંગો કાંઈ કામ ન આપી શકે. ત્યારે તો ધ્યાન જ કામ આપી શકે. ધ્યાન અંતર્દેશ સાધન છે. ધારણા, ધ્યાન અને સમાપ્તિને અંતર્દેશયોગ કરેવામાં આવે છે અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારને બહિરંગ યોગ કરેવામાં આવે છે, તે બદારનાં સાધનો છે. ધારણા, ધ્યાન અને સમાપ્તિ તે પણ

જ્યાં સુધી સંમશાત હોય ત્યાં સુધી અસંપ્રશાતની તુલનામાં તેને પણ બહિરંગ કહેવામાં આવે છે.

જ્યાં સુધી તે કલેશો સ્થૂળ હતા, બહાર હતા ત્યાં સુધી યોગના બહિરંગોએ કામ આવ્યું અને કલેશોને સૂક્મ કરી નાખ્યા. પરંતુ જ્યારે તે કલેશો સૂક્મ થઈને પોતાની જન્મભૂમિમાં પહોંચી ગયા ત્યારે યોગના આ બહારનાં અંગો કામ ન આપી શકે, ત્યારે તેમને હટાવવા માટે તો ધારણા, ધ્યાન અને સમાચિ જ કામ આપે. તેથી આ સૂક્મમાં ધ્યાનનું સાપન બતાવ્યું છે. ધ્યાન એટલે અંતરંગ સાપન સમજ લેવાનું છે. આ વાતને સમજ્યા માટે પણ એક સ્થૂળ દધ્યાંત આપીએ.

લોડાની મજબૂત પેટીમાં મૂકેલી સોપારીને તોડવા માટે તે પેટી ઉપર ઘણના યા મારીએ તો સોપારી તુટે? ના તુટે. સોપારી જ્યારે બહાર પડી હતી ત્યારે મામૂલી હંદોડીથી પણ તૂટી રહકી હતી. પરંતુ જ્યારે તેને લોડાની પેટીમાં સુરક્ષિત કરી દઈએ અને પછી પેટી ઉપર ઘણના

યા મારીએ તો પણ અંદરની સોપારી ઉપર કાંઈ જ અસર થાય નહીં. કેમ કે સોપારી અંતરંગ થઈ ગઈ. હવે તો તિજોરીમાંના અંદરનાં જ કોઈ અંગો, સાપનો દ્વારા તેના ઉપર કાંઈ અસર કરો શકાય. જે અંતરંગ અને સૂક્મ અવસ્થામાં પહોંચી ગઈ તેના ઉપર અસર કરવા માટે અંતરંગ અને સૂક્મ સાપનોની જરૂર પડે.

તો આમ, જે સૂક્મ અવસ્થામાં પહોંચી ગયા છે તેવા કલેશોને ત્યાંથી પણ બળી નાખવા માટે, દરખબીજ બનાવી નાખવા માટે, ત્યાંથી ફરીને જન્મી ન શકે તેવા કરવા માટે ધ્યાનનો ખૂબ જ અભ્યાસ કરવો જોઈએ. જેથી ધ્યાનાંગ્રિ પ્રગત કરવો જોઈએ કે તે અંગ્રે દ્વારા; અથિ સૂક્મ અવસ્થામાં પોતાની જન્મભૂમિમાં રહેલા એવા જે પાંચ કલેશો તે ત્યાંથી પણ બળીને ભસ્મ થઈ જય, જેથી ત્યાંથી પણ ફરીને ઊગી ના શકે. ધ્યાન વિધેની ઘડી મહત્વાં આપણે આ અગ્નિધારમા સૂત્રમાં સમજ્યા.

(કમશઃ)

## પુરુષોત્તમ માસ એટલે ઉત્તમ પુરુષ ચચાનો માસ

-લોગનિષ્ઠુ

મંદિર જાય ત્યારે ખોરી સોપારી,  
પોતે સારી ખાય,  
અભાગણી પુરુષોત્તમ મહિનો ન્યાય!

જુ પુરુષોત્તમ માસ આવી રીતે નહાવાનો? પોતે સારું સારું ખાવું-ખીરું, પદેરસું-ઓઢવું અને મંદિરના ભગવાનને અને કથા વાંચનાર મહારાજને ખોરું-ખોરું પરાવવાનું અને આપવાનું? અન્યોને છેતરવામાં પોતે જ છેતરાઈએ છીએ તેવી ઉત્તમ સમજ્યા ઉત્તમ મહિનામાં પ્રામ નહીં કરવાનો?

“પુરુષોત્તમ માસની કથા” નામના પુસ્તકમાં તો જાતજ્ઞતની ચિત્રવિચિત્ર ચાતો કહેવાયેલી છે. પણ તે જરૂરીયાં સાર છે ઉત્તમ કાર્યો કરીને ઉત્તમ બનવાનો. નિર્ધારિત સમયે નિર્ધારિત પર્વો આવે છે. પુરુષોત્તમ માસ

દર ગ્રાજ વર્ષે પ્રેરણવિભૂતિ જાતજ્ઞતને “આત્મએક” મંત્રથી ચાક્રાંકદ્વારે છે. અધિક માસનો ગર્ભ જ એ છે કે તે માસમાં કાંઈક અધિક - કાંઈક વિશિષ્ટ ગર્ભ કરવું જોઈએ.

કોઈપણ ભોગ સુખી થવા માટેની જે આંધળી દોડ મનુષ્યે મૂકી છે તેમાં “રુક જાવ અને આત્મનિરીક્ષણ કરો” ની બ્રેક પુરુષોત્તમ માસ લગાવે છે. દર ગ્રાજ વર્ષે આ માસ એ વિચારવાનો મોકો આપે છે કે ઉત્તમ કાર્યો કરીને તમે કેટલા ઉત્તમ બન્યા? “માતાને એમ લાગે છે કે દીકરો મોકો વઈ રહ્યો છે પણ દીકરો તો મૃત્યુ તરફ પસો રહ્યો છે” તે કહેવત છેવું આપણું જીવન છે. આ જન્યે તો થોડું સુખ પ્રામ થયું છે પણ આવતા જન્યે પણ સુખરાંતિ પ્રામ થાય એવું કાંઈ કર્યું? કે પછી પુમાદાને જ બાયકા ભરતા રહ્યા અને સમય પૂરો થઈ જવા આવ્યો?

ભારતીય સંસ્કૃતિમાં પણ ની ઘણી મોટી મહત્વા છે. પણ એટલે અન્યો માટે કાંઈક ત્યાગવું. વધુમાં વધુ પ્રિય વસ્તુને ત્યાગવી તે ઘણો મોટો પણ ગણાય છે. "ત્યાગને જ બોગ સમજ" એ સૂત ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે.

ગીતામાં કહું છે કે ઘણોમાં જપયત્ત હું હું. જપયત્તને આટલો શ્રેષ્ઠ ચા માટે ગણ્યો હશે? કારણ કે જપયત્ત સાવ સહેલો, સસ્તો અને બહુમૂલ્ય છે. અન્યો માટે શુભ બાવના રાખવી કે વહાવવી તેને ઋખિઓ પણ સમાન લેખે છે. મનુષ્ય વિચારે છે કે હું તો સાવ ગરીબ હું, કરીતે પણ કરી શકું? ગરીબ અને તર્વંગર સહુ કોઈ જપયત્ત કરી શકે છે, છ્યવમાત્ર તરફ શુભ બાવનાઓ વહાવી શકે છે.

શુભ બાવનાઓનું, શબ્દોના માધ્યમથી રટા કરવું તે જપયત્ત કરવાય છે. ઉપલક દાખિએ, શુભ બાવના રાખવાની વાત બહુ મહત્વની નથી લાગતી પણ સૂક્મ રીતે જોતાં તેની મહત્વા જરૂર સમજાય છે. મનુષ્ય જેના સંગમાં સતત રહે છે તેવો તે બને છે. મનુષ્ય વધુમાં વધુ પોતાના વિચારોના - પોતાની ભાવનાઓના સંગમાં રહે છે તેથી જેવું તેનું વિચારસાતત્ય હશે તેવો તે બનશે. પોતાની સારી-માડી ભાવનાઓ પ્રમાણે પોતે તો બને જ છે પરંતુ અન્યો ઉપર પણ તેની ઘણી જોરદાર અસર થતી થયે છે. કોઈની આપણે નિંદા-પ્રશંસા કરીએ તેની સારી-માડી અસર તેના ઉપર જરૂર થાય છે. શાબ્દશક્તિ અમોદ છે.

જેમની ભાવના ખરેખર જ પણ કરવાની છે તેમના માટે અનેક મોકા છે, પણ જેમને બહાનાં બતાવીને છટકી

જવું છે તેમના માટે "આખિર પૂલ કી પૂલ" જ રહેવાની છે.

વર્તમાનકાળમાં પાણીની કેટલી હાડમારી છે? પાણીની કાળજી માટે અનેક વખત સાવધાન કરે છે, પણ જાણે શેને કહે છે! આપણા નળો તો બેફામ ચાલુ, બાલટી છલકાઈને પાણી નહાર પસમસી રહ્યું છે, આપણે બાજુમાં જ બેના છીએ પણ નળને બંધ કરવા કેટલી પણ આપણા છોડતા નથી! જ્યાં સુધી આપણા ગોળામાં પાણી છે ત્યાં સુધી પાણીની હાડમારીની વાત આપણને સાચી જ ના લાગે તે કેટલું જપયત્ત કરવાય! આ જપયત્ત ના છૂટે તો પછી બલેને ગમે તેટલા પુરુષોત્તમ માસ નહાઈએ એથી શું? ઉત્તમ મહિનામાં આપણે કયું ઉત્તમપણું મેળવ્યું? અરે! આપણે ત્યાં નીકળતો એંદ્રવાડ કે શાકભાજી કે ફળાદિનાં છોતરાં પણ જો લેગા કરીને ઢોરને મોઢે જાય એવી વ્યવસ્થા કરીએ તો ય સાવ મફતમાં જ કેટલાય જીવેને સરતા બચાવી શકીએ.

આવી ઉત્તમોત્તમ વાતોને પુરુષોત્તમ માસમાં આપણે કટી યાદ કરીએ છીએ? પુરુષોત્તમ માસની સાચી કથા તો આવી વાતોમાં રહેલી છે. કેટલા બધા પુરુષોત્તમ માસ પસાર થઈ જયા, અને આપણાં વર્ષો પણ પસાર થઈ જયાં તો ય ઉત્તમપણું પ્રામ ના થયું. દોષિયાર વ્યક્તિ દરેક માસને ઉત્તમ માસ બનાવી હે છે અને મારા જેવો જરૂરસત પુરુષ અનેક ઉત્તમ માસ નાલીને પણ જરૂરસત અને જરૂરસત જ રહે છે. અનઉત્તમ પુરુષ જ રહે છે.

કહની મિસદી ખાડ હે, કરની તત્ત્વ લોહ;

કહની કહે અને રહની રહે, જૈસા વિરલા કોક.

જે બુદ્ધિ સમર્પિત થઈને રહે છે તે જ બુદ્ધિની બુદ્ધિમાની છે. ગુરુજનો અને સંતજનોના ચરણોમાં બુદ્ધિપૂર્વક નિર્બુદ્ધ થઈ ને બેસવું એ જ બુદ્ધિમાનપણું છે.

-યોગભિક્ષુ

## ગંગોશા ગંગોગીરીની ચાત્રાએ

મંકલન: શેખર પટેલ

ઓમુ પરિવારના એકને આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લઈએ એટલે વર્ષ દરમાન જિજ્ઞાસા દરેક કાર્યક્રમમાં ભાગ લેવાનું મન થાય છે, મન દરેક કાર્યક્રમમાં હજું આપવા જાતં હોય છે. સમય જતાં, ઓમુપરિવારના આધિસંસ્થાપક પ.પુ. ગુરુદેવ શ્રી યોગનિષ્ઠુણની વધુમાં વધુ નિકટ રહેવાની તાત્ત્વાવેલી થાય છે, સદાય પૂજયશ્રી સાથે રહેવાની ઈચ્છા રહ્યા કરે છે.

અંતરની આ ઈચ્છા પૂજયશ્રી સાથે ગંગોની-યાત્રામાં જોડતાં પૂર્ણ થઈ, પુ. ગુરુદેવ સાથે ગાળેવા અવર્ગનીય દિવસોની ચર્ચા મિત્રવર્તુળમાં, ગુરુપ્રેમીઓમાં થતાં તે સૌની જિજ્ઞાસા વધવા લાગતી, પુ. ગુરુદેવ સાથેની અખલઘ્ય શાનની વાતો જાણવા મુંમુખુઓ ઉત્સુક રહેતા.

મારા જેવો અણાની પુ. ગુરુદેવ સાથેની યાત્રા વિષે શું લખી શકે? છતાં યથોચિત મારી બુદ્ધિ પ્રમાણે જે કાંઈ લખ્યું છે તે અહીં રજૂ કરું છું, વાયકમિત્રોને નમ વિનંતી કે અહીં રજૂ કરતા લખાણને તેમો નીરકીર ન્યાયે તોંણે.

૧૯૮૭ ના અન્ધ્રિલ માસમાં શ્રી ભરતભાઈ પરીએ જભારે મને પૂજયું કે, “શેખરભાઈ, ગંગોની આવવું છે?” મેં તરત છા પાડી દીધી. પૂજયશ્રીની વેખરીમાંથી નીકળતી જ્ઞાનગંગાને તેમની ઉપરિસ્તિમાં પાણ કરવાનું સૌભાગ્ય સાંપડતું હોય પછી બીજું શું જોઈને? અને જ્યારે જ્ઞાનગંગા વહાવતા પૂજયશ્રી શિવનું સાકાર સ્વરૂપ જ લાગતા હોય ત્યારે તેમની સાથે યાત્રામાં જોડવાની આણા મળે એ શું ઓહું કહેવાય? પૂજયશ્રીની વાણીમાંથી સતત વહેતી ગંગાજીનું પાણ કરતાં જ મનમાં થયા કરે કે “ગંગોશા” માઝે જ છે પછી બીજે શા માટે કંદાં મારવાં? અસ્તુ.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ તા.૮-૫-૯૭ના શુભ દિવસે ખાપોરે ૧૨-૦૦ વાગ્યે સર્વોદય એકસપેસમાં નીકળવાનું હતું, તે દિવસે નિયત સમયે ઓમુપરિવારના ગુરુપ્રેમી

બાઈબહેનો પૂજયશ્રીને વિદ્યાય આપવા રેલ્વેસ્ટેશને એકંઠાં થવા લાગ્યો, લગ્નભગ ૧૧-૩૫ કલાકે ટ્રેન આવી, અમારી સાથે યાત્રામાં ડો. સદ્ગુરુસમર્પણાભિસુષ્ણ, પેંકાલભાઈ શાઢ, દામોદરભાઈ પટેલ, શ્રી ગુરુધ્યાનભિસુષ્ણ, ભરતભાઈ પરીખ, જિધિનભાઈ શાડ, કાન્નિભાઈ પટેલ જોડવાના હતા. ટ્રેન ખેટકોર્મ પર આવી ગઈ હતી હરેતુ ડો. સદ્ગુરુસમર્પણાભિસુષ્ણ આવ્યા નહોતા, પૂજયશ્રીએ મજાકમાં કંદું પણ ખરું કે ‘‘ટ્રેન મોડી ઉપડવાની હશે એની ડોકટરને ખબર છે કે શું!!’’ અને એટલામાં જ સ્ટેશન ઉપર જાહેરાત થઈ કે ટ્રેન વીસ મિનિટ મોડી ઉપડશે, કેવો જોગનુંજોગ!

ટ્રેન લગ્નભગ વીસેક મિનિટ મોડી એટલે કે ૧૨-૨૦ કલાકે ઉપડી, ખેટકોર્મ ઉપડ ઊભેલાં સૌ ગુરુભાઈબહેનોએ ‘સત્ય-ધર્મગુરુદેવની જ્યા’ બોલાવી, ‘સત્ય-ધર્મગુરુદેવની જ્યા’ ના નારાશી આપું ખેટકોર્મ ગુંજું ઉઠ્યું.

પૂજયશ્રીની તથિયત સારી નહોતી, એક સિટનું રિઝર્વેશન પણ ઓહું હતું, સામાન વણો હતો, ટ્રેન ઉપડતાં જ સામાન વ્યવસ્થિત કરી ડો. બિબુલ્યાએ પૂજયશ્રી નાટે બેઠિંગ પાથર્પું, પૂજયશ્રીએ કહું, “ભાઈ મારી આટલી બધી ચિંતા ના કરો, યાત્રાએ જરૂર હોય તો થોડી તકલીફ કેઠવી જ જોઈએ.” છતાં ભક્તોની ભાવનાને ઠેસ ના પહોંચે તે કારણે પૂજયશ્રીએ આરામ કરવાનું પસંદ કર્યું.

પૂજયશ્રીએ એક જ વાક્યમાં ઘણુંબણું કહી દીધ્યું, તકલીફ વિના યાત્રાની મજા નહીં, કેમ તપ વિના સિદ્ધિ નહીં, સુખની ખબર હુંબ પડ્યા વિના પડે અરી? કાંઈક મેળવવું હોય તો કાંઈક ગુમાવવું તો પડે જ ને? વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ વસ્તુ નાશ પામતી નથી, માત્ર આકાર, કદ અને સ્વરૂપ બદલાય છે, આધાત અને પ્રત્યાવાત સરખા અને સામસામા હોય છે, અસ્તુ.

ટ્રેનમાં બધા પૂજયશ્રી સાથે આનંદપૂર્વક વાતો કરતા

હતા. પૂજયશ્રીએ બધાને પૃથ્વેનું: "આટલા જખા હિવસ તમારામાંથી કોઈ પોતાની પત્ની અને બાળકો સિવાય બહારગામ ગયા છો?" સૌઅં ના કહી. પૂજયશ્રી કહે, "ગૃહસ્થાશ્રમમાં પણ સંયમી જીવન જીવનું થયું અગત્યનું છે. બ્રહ્મચર્ય એ તેજનું ધોતક છે. અમે તમને સૌઅં એ પણ કહેવા માગીએ છીએ કે આચારાત્મિક ઉન્નતિ માટે દરેક સંયમ અને નિયમ પાળવા જોઈએ. ધરથી, પત્નીથી વર્ષ દરમિયાન અમૃત સમય દૂર રહી અભ્યાસી થયું જોઈએ. બાળકોથી થોડો સમય દૂર રહી સમતામાંથી-મોહમાંથી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ."

અમારી ગાડી સત્તામ સ્ટેશને પહોંચી અને એન્જિન બગડ્યું. એન્જિનમાં બરાબીના કારણે અમારી ગાડી સત્તામ સ્ટેશને બે કલાક પડી રહી. બીજું એન્જિન આવ્યું અને ગાડી સાથે જોડાયું એટલે ગાડી આગળ ચાલી. આ પ્રસંગે પૂજયશ્રીએ મુહમાં આવીને અમને જણાવ્યું કે-

"ભાઈ, આપણા જીવનનું મનરૂપી એન્જિન જે બગડી જરૂર તો ગાડી ખોટકાઈ જરૂર. મનને સારા વિચારોથી બરી રાખજો. મનને બગડવા ના દેશો. તમારી જીવનગાડીને એવું એન્જિન લગાડજો કે જે તમને તમારા અંતિમ મુદ્દમે નિર્વિને લઈ જાય."

આ પ્રસંગ વાંનુંબધું શાન આપી દે તેવો છે. પરમચૈતન્ય પરમાત્માને પામવા હરો તો મનનો મેલ દૂર કરવો પડશે. મનને સતત ગુરુમય બનાવવું પડશે, પ્રબુમય બનાવવું પડશે. ઈશ્વરની શરણાગતિ સ્વીકારીશું તો જ તેઓ આપણી જીવનરૂપી ગાડીના એન્જિન-સારથી બનશે, અને તો જ આપણે આપણા અંતિમ ધ્યેય - મોશને પામી શકશું.

અસ્તુ.

તા.૮-૫-૮૦ ના રોજ સવારે ૮-૦૦ કલાકે દિલ્હી પહોંચા. સેશન ઉપર ગુરુપ્રેમી શ્રી અમૃતભાઈ હાજર હતા. તેમણે પૂજયશ્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું. અમારે દિલ્હી રોકાવાનું નહોંતું, સીમા ઝાંખિકેશ જવાનું હતું. અમૃતભાઈને મેટાડોરની વ્યવસ્થા કરેલી. મેટાડોર દસ

વાજ્યાને બદલે અજિયાર વાગે આવી. અમૃતભાઈની આગ્રહભરી વિનંતીને માન આપી પૂજયશ્રીએ મેટાડોર તેમના ઘર તરફ લેવણાવી. ત્યાં જઈ બધાએ હાથ-માં પોઈ નાસ્તો કર્યો. સમય ઓછો હતો એટલે બધાએ સાન ન કર્યું. પરંતુ મેં સાન કરવાનો આગ્રહ રાખતાં મારી સાનકિયા બાદ પૂજયશ્રીએ મને કહ્યું કે, "શેખરભાઈ તમને સાન કરતાં કેટલી વાર લાગી? દસ મિનિટને? આપણે નવ જણ સાન કરવાનો આગ્રહ રાખીએ અને દરેકને દસ મિનિટ સાન કરતાં થાપ તો કુલ કેટલી મિનિટ બગડે? આપણાને કેટલું મોંટું થાપ?" આમ પૂજયશ્રીએ તેમની માર્ભિક વાણીમાં ચિસ્તાનો પહેલો પાડ મને ભણાવ્યો. ત્યારબાદ હસતાં હસતાં કહ્યું કે "તો શેખરભાઈને નડી લ્યો એટલે દરેકને સાન કર્યા બરાબર થઈ જશે." પ્રશ્નવંદના ગાઈ બરાબર બપોરે સવા વાગ્યે અમે ઝાંખિકેશ તરફ જવા પ્રયાશ કર્યું.

સ્લો ઘણો લાંબો હતો. ઢોળાવવાના વાંકાચુંકા રસ્તા ઉપર અમે ઊંચે ને ઊંચે જઈ રહ્યા હતા. એક બાજુ ઊંચા પર્વતો અને બીજી બાજુ ઊંચા અને મેદાનો. ઊંચાવાળા મેદાનના ભાગમાં લીલાંછિમ ખેતરો લહેરાતાં હતાં. ઉપર જઈ રહેલી મેટાડોરમાંથી જોતાં એવું લાગતું હતું કે ધરતી પર જોતો લીલી ચાદર જિલાવી છે! વચ્ચે નાનાં નાનાં જરણાં અને કેડીઓ સાચિયા પુરતાં હતાં. ક્યાંક ક્યાંક હોર પણ નજરે ચઢતાં હતાં. ઊંચાની પેલી બાજુ આવેલા પર્વતો ઊપર ઊગેલાં તોતિંગ વૃક્ષોનું ડેલન સંગીત ઉત્પન્ન કરતું હતું. આ, પ્રકૃતિની સુંદર લીલા જોતા જોતા અમે સૌ આગળ વધી રહ્યા હતા.

આખી રાતની ટ્રેનની મુસાકરી છતાં પૂજયશ્રી અને અમે બધા આનંદથી વાતો કરતા હતા. પૂજયશ્રીને થાક લાગ્યો હોવા છતાં તેઓ અમને શાન પીરસતા જતા હતા. વાતમાં ને વાતમાં તેમણે પંકજભાઈને પૃથ્વેનું કે, "તમારે કેટલે ઊંચે જવાનું છે? જોયું ને? એક બાજુ ઊંચા અને બીજી બાજુ પર્વતો. બંનેની વચ્ચે વાંકાચુંકો રસ્તો." આટલું કહી પૂજયશ્રીએ વાંકું બાંકું સાનમાં સમજાવી દીધું. જીવનપથમાં પણ જો આપણે આગળ વધતું હરો,

આધ્યાત્મિક ઉન્નતિ કરવી હશે તો મોહ-માપા-મમતારૂપી જીવાણમાં ગબડી ના પડીએ તેનું ધ્યાન રાખવું પડશે. માપારૂપી ખોલ અને ત્યાગરૂપી પર્વતોની વચ્ચેથી પસાર થતા રસ્તા ઉપર ગમે તેટલા વળાંક આવે તો મણ આપવો નિર્ભય બની આગળ વધવું પડશે, જો આધ્યાત્મિક શિખશો સર કરવાં હશે તો.

સાંજે સવા સાત વાગ્યે અમે ઋષિકેશ પહોંચ્યા. ત્યા પંચાયતનુંબન પાસે આવેલ કાલી કમલીવાળા બાળાની પર્મશાળામાં રોકાયા. બધા મુસાફરીથી થાકેલા હતા એટલે પૂજયશ્રીએ સોને નાસ્તો કરી આરામ કરવા જઈથાયું. નાસ્તો કરતાં કરતાં બાબા કમલીવાળા સંતનો દૂંશે પરિચય આપતાં પૂજયશ્રીએ કહ્યું-

“કાલી કમલીવાળા સંત તપશ્ચર્યા દરમ્યાન શરીર પર માત્ર કાળો કામળો જ ધારણ કરતા તેથી તેમનું નામ ‘કાલીકમલીવાળા બાબા’ પડેલું. તેમને તપશ્ચર્યા દરમ્યાન જે જે તકલીફો પડેલી તે બીજા સંતોને ના પડે તે માટે તેમણે દિમાલયની ગોદમાં અનેક આશ્રમો, પર્મશાળાઓ અને અન્નકેન ચાલુ કર્યો. દરદર, ઋષિકેશ, ઉત્તરકાશી, ગંગોત્રી વગેરે અનેક યાત્રાધારોમાં તેમના આશ્રમો અને પર્મશાળાઓ આવેલી છે. અન્નકેનમાં અનેક સાધુ-સંતોને બોજન અપાય છે. આપણો જે પર્મશાળામાં જીતર્યા છીએ તે પણ તેમની સંસ્થા દ્વારા જ ચાલે છે.”

નાસ્તો પતાવી થાકેલા-પાકેલા અમે સૌ સૂઈ ગયા. બીજે દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે જીહી ગયા. સવારે ૫-૪૫ કલાકે મુનિ કી રેતી નામના સ્થળે જવા નીકલ્યા.

મુનિકી રેતી એટલે ઋષિકેશનું આધ્યાત્મિક સ્વર્ગ. ત્યા પહોંચ્યા કે કુદરતનું અવિસરણીય સ્વરૂપ દિણિયોયે રથ્યું. વિશાળ પટમાં ગંગાજી ખળગળ વહેતાં હતાં. નદીના બંને કાંઠે, વનરાજુની વચ્ચે આવેલા જુદા જુદા આશ્રમો અને મંહિરોની પણાં વહેરાતી હતી. બાવિક ભક્તો ગંગાજીમાં સ્નાનનો લદાવો લઈ રહ્યા હતા. અમે આ બધું માણસતા હતા ત્યારે પૂજયશ્રી ગંગાધારની

પાણી પાસે જીબા રહી કુદરતની કળાને નીરખી રહ્યા હતા. પોતાની ભૂતકાળની મુલાકાતને વાગ્યેળી રહ્યા હતા.

થોડા સમય બાદ અમે સ્વર્ગાશ્રમ જવા નીકળ્યા. પ્રથમ ગંગાધારે આવ્યા કે જ્વાંથી હોડીવાળા જામે કિનારે લઈ જાય છે. વહેલી સવાર હોવાથી હોડીએ બંધ હતી. તેથી અમે ચાલતા ચાલતા શિવાનંદ જૂલા ઉપર આવ્યા. આજો પુલ માત્ર વાયરનાં દોરડાંથી બનાવેલ છે. કશાંના લાકડાનાં પાટિયાં છે. નીચે ક્યાંય થાંબલા નથી. તેની લંબાઈ પણ ખાસ્તી નણસો મીટર જેટલી છે. શિવાનંદ જૂલા ઉપરથી પસાર થતા હતા ત્યારે પૂજારુદેવની મૃત્તિને પોતાના કેમેરામાં જરૂરી લેવા ગુરુધ્યાનભિસુ કટાકટ કેમેરાની ચંપ દબાવ્યે જતા હતા. આ જોઈ પૂજયશ્રીએ ટકોર કરી- “ધ્યાનભિસુણ, બધુ કોટા ના પાડશો. કુદરતને તમારા કેમેરામાં તેટલી સમાવી શકશો?”

જૂલાની બરાબર વચ્ચે આવી બંને બાજુઓ, નીચે જોયું તો કિલાકિલાટ કરતી ગંગાની મસ્તીને માણસા મળી. બંને કાંઠે જિચી જિચી પર્વતોની હારમાળા અને તેના ઉપરના જિચા છતાં સીધાં સોટી જેવાં વૃક્ષો! પર્વતોની વચ્ચેથી ક્યાંક ક્યાંક જરણાંઓની સંકેદ દૂધ જેવી જળચાણ ગંગાજીને મળવા પસમસતી નીચે દોડી રહી હતી. આશ્રમોની કેસરી અને સંકેદ પણાં લહેરાતી હતી. કેસરી પણાં જાણે અમને આદ્યવાન આપતી કહી રહી હતી કે અલખને મેળવવા કેસરિયાં કરો તો જ અમારી માફક દિગંતમાં લહેરાશો. તો સંકેદ પણાં હશાયો કરી રહી હતી કે જો ચિર શાંતિ પ્રામ કરવી હોય તો અહી આવો, આ સ્થાન ચિર શાંતિ મેળવવાનું છે.

નદીના બંને કાંઠે ભાવિક ભક્તો નદીમાં જીબા જીબા સાન કરી રહ્યા હતા તો કોઈક સૂર્યનારાયણને અર્થ આપી રહ્યા હતા. દૂર દૂર બરફાચાદિત સંકેદ પહેઢો દેખાતા હતા. સમગ્ર વાતાવરણ અવર્ણનીમ હતું. આમ કુદરતની કળાને માણસતા માણસતા અમે શિવાનંદ જૂલાને પસાર કર્યા

સામા ઉનારે પહોંચા, તાંકી સ્વર્ગાશ્રમ ગયા, પૂજયશ્રીએ ડૉ. બિલુ અને પંકજભાઈને આશ્રમ વિષેની માહિતી મેળવવા મોકદ્યા, તેઓ તપાસ કરી પાછા આવ્યા અને જ્યાબું કે કુલ ૧૧૮ રૂમ છે, તેમાં અમૃત રૂમમાં ભાષ્યરૂમ છે, ધ્યાનઘંડ અલગ છે, તેમાં બધી સગવડ છે, તપસ્વીઓ અને ત્યાગીઓ માટે જુદી વ્યવસ્થા છે, અનસેત્ર પણ ચાલે છે, બોજનની સંપૂર્ણ વ્યવસ્થા છે, આશ્રમમાં શિવછનું એક સુંદર મંદિર પણ છે, આશ્રમ ખૂબ સ્વચ્છ છે.

સ્વર્ગાશ્રમમાંથી નીકળી અમે પરમાર્થનિકેતન આશ્રમમાં ગયા, તે આશ્રમની જગ્યા ધર્મી વિશાળ હતી, આશ્રમમાં નાના-મોટા થઈ કુલ આદસો પચાસ રૂમ હતા, આ આશ્રમમાં કાચનું મંહિર હતું, તેમાં આશ્રમના સ્થાપક સંતની મૂર્તિ હતી, આશ્રમમાં ચારે બાજુ ફરતી નાની નાની દેરીઓ હતી, દેરીઓમાં રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગુરુનાનક, સંત કલીરજી વગેરે સંતોની મૂર્તિઓ હતી, આશ્રમનું વાતાવરણ શાંત અને ભક્તિસભર લાગતું હતું, મનને ખૂબ શાંતિ આપે તેવું હતું.

પરમાર્થનિકેતન આશ્રમમાંથી નીકળી અમે સૌને નાસ્તો કર્યો, નાસ્તો કરી અમે ગંગાથાટે ગયા, પૂજયશ્રીએ એક ઊંચા પથર ઉપર આસન જમાબું, પૂજયશ્રીને જોઈને જોવું લાગતું હતું કે જોંશે કેલાસપર્વત ઉપર શંકર ભગવાન ધ્યાનમાં ના બેઠા હોય ! જોયા જ કરીએ, થોડા સમય પછી પૂજયશ્રીએ સૌને સ્નાન કરવાની આશા આપી, વારાફરતી બધા ગંગાછમાં સ્નાન કરવા જિત્યા, ડૉ. બિલુજી અને પંકજભાઈ ગંગાછના બરક જેવા ઠંડા પાણીમાં સ્નાન કરવા ના જિત્યા, પૂજયશ્રીએ તે બંનેને કહ્યું કે, “અહીં સ્વર્ગાશ્રમ પાસે સ્નાન કરતું એ તો લદાયો છે, તમે બંને પણ સ્નાન કરી લ્યો.” પૂજયશ્રીના આગ્રહને વશ થઈ તેમણે પણ સ્નાન કર્યું, સ્નાન કરી સી પૂજયશ્રીના ચરણોમાં બેઠા, પૂજયશ્રીએ ગંગાજળ-ગંગાસ્નાનનો મહિમા વૈશ્વાનિક રીતે સમજાવતાં કહ્યું કે-

“ગંગાછના પાણીમાં અનેક જરણાં મળે છે, આ

જરણાં જે કુંગરાઓમાંથી આવે છે તે કુંગરા ઉપર હિંબ વનસ્પતિ ઉગે છે કે શરીરના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે, જરણાંઓનું પાણી આવી વનસ્પતિને સર્વાનિ, ધસાઈને આવે છે તેથી તે પાણીમાં આવી વનસ્પતિઓનું સત્ત્વ મળે છે, આવા અસંખ્ય જરણાંનું પાણી ગંગામાં છલવાય છે, ઉપરાંત અનેક સંતો, મહિતો, યોગીઓ દરરોજ ગંગાછમાં સ્નાન કરતા હોય છે, તેમના શરીરમાંની ચેતના-વિદ્યુત-પ્રાણ-તેજ-ઓજ આ પાણીમાં ભણે છે, આમ ગંગાજળ વૈશ્વાનિક રીતે જોતાં પણ કાયદાકારક છે, તે ફક્ત ધાર્મિક દાખિએ જ નહીં પરંતુ આરોગ્યની દાખિએ પણ ધ્યાબું ઉપયોગી છે.”

ઉપરોક્ત સત્તસંગ કરી પૂજયશ્રી અમને સૌને બાબા કાલી કમલીવાલાનું અનન્દેત્ર જોવા લઈ ગયા, અહીં અનેક સાધુ-સંતો તથા તપસ્વીઓ સવારના પૂજા-પાઠ પણ તેમનું સવારનું બોજન લઈ જાય છે, વહુ સમજણા આપતાં પૂજયશ્રીએ જ્યાબું કે, “આ બધા સાધુ-સંતો કોઈ સામાન્ય માણસ હોતા નથી, તેમાંના કેટલાક તો ડોક્ટર, એન્જિનિયર કે ઉલલ ગ્રેજ્યુએટ હોય છે, તેઓ પૂર્વાશ્રમમાં ધર્મા સુખી હોય છે પરંતુ અલખને પામવા અહીં તપ કરવા આવી જાય છે, આ બધા સંતો નહીંદિનારે આવેલ મણીકૂટ પર્વતમાં નાની નાની ગુફાઓમાં રહી તપ કરતા હોય છે, મણીકૂટ પર્વતમાં આજે પણ ધર્મા બધા સંતો તપ કરે છે, આપવો તે સંતોનાં દર્શન કરવા જ્યા બધે કરી શકવાના હતા? એટલે અહીં અનન્દેત્ર પાસે જીબા રહેવાથી આવા તપસ્વીઓનાં દર્શનનો લાલાયો મળી જશે.”

પૂજયશ્રીની કેટલી નમ્રતા ! ભગવાન ભક્તનાં દર્શન કરવા કેવા આતુર હોય છે એ મેં ત્યાં જોયું, સ્વયં ઓમ્ભસ્યરૂપ હોવા છીતાં, ઓમ્ભસ્ય થવા હિંચતા તપસ્વીઓને જીશે પ્રેરણા આપવા, દર્શન આપવા જ પોતે ના જીબા રહ્યા હોય, તેમ પૂજયશ્રી લગભગ અડધો કલાક ત્યાં જીબા રહ્યા, પૂજયશ્રી શુદ્ધ સંકેદ વળોમાં સજ્જ હતા, ધર્મા સંતો પૂજયશ્રીના દર્શન કરતા કરતા ત્યાં જ જીબા રહી જતા, પૂજયશ્રીને પગે લાગી, નારાયણ

કરી આગળ વધતા. એક-બે સંતો સાથે પૂજયશ્રીને  
વાતો પણ કરી. લગભગ અઠથો કલાક ત્યાં ઊભા રહી  
અમે હોડીમાં બેસી પાછા સામા ઉનારે આવવા નીકળ્યા.

ગંગાજીના જગતમાં મંદ ગતિઓ હોડી સરકી રહી  
હતી. બધાના મનમાં એક વિચાર ચાલતો હતો કે  
અમારા માનવજીવનનુંપી ભવસાગરમાં ગુરુજી સદાય  
અમારી નોકામાં સાથે રહે તો કેવું સારું? ભવસાગર  
તરતાં જરાય તકલીફ ન પડે. પૂરુષુદેવ અમને ભવપાર  
ઉતારી અમારું માનવજીવન સાર્થક કરાવે એવી અંતર્થી  
અમે સૌ પ્રાર્થના કરતા હતા. થોડી જ વારમાં અમે  
મુનિ કી રેતી વાળા ઉનારે આવી પહોંચા. ટેખ્મો-રિલા  
કરી બધા ધર્મશાળાને આવ્યા.

ધ્યાન દિવસે અમે બધા ચાલીને આટલું કર્યા હતા.  
થાક ધણો લાગ્યો હતો. બૂઝ પણ હતી જ. અમદાવાદથી  
જ રસોઈનો બધો સામાન સાથે લઈ ગયા હતા. દમાભાઈને  
જરૂરથી જીચડી અને શાક બનાવી દીધાં. પૂજયશ્રીને  
બોજન-પ્રસાદ કરાવી સોએ બોજન કર્યું. સાંજે ઉત્તરકાશી  
જવાનું હોઈ બધાને થોડો આરામ કર્યો. સાંજે બધો  
સામાન પેક કરી ટેક્ષીવાળાની રાણ જોતા હતા. એટલામાં  
જ ટેક્ષીવાળા કોઈ કાર્યસર ના પાડી ગયા. સાંજે પણ  
દાખે રસોઈ બનાવીને જર્યા. આશ્રમની શિસ્ત મુજબ  
સોએ કામની વહેંચણી કરી લીધી હતી. દાખે રસોઈ  
બનાવવાની પણ ખૂબ મજા પડતી. સાંજનું વાળું પતાવ્યા  
બાદ અમે ફરવા નીકળ્યા.

ભરતમિલાપ મંદિરે ગયા. અમને એવા સમાચાર  
મળેલા કે સત્ત્રદેવજી મહારાજ નામના સંત કે જેઓ  
માઉન્ટ આનુ મુકામે પૂજયશ્રીને મળેલા તે અહીં હતા.  
ભરતમિલાપ મંદિરેથી સમાચાર મળ્યા કે શ્રી સત્ત્રદેવજી  
મહારાજ માયાકુડ કેત્રમાં છે. અમે માયાકુડ ગયા,  
માયાકુડમાં આવેલ શ્યામકુંજ નામના નાના છતાં સ્વચ્છ  
અને રમણીય આશ્રમમાં અમે પ્રવેશ્યા. આશ્રમમાં ઘઘવ  
થતાં જ પૂજયશ્રીને સત્ત્રદેવજીને જ્યનારાયણ કર્યા.  
સત્ત્રદેવજી મહારાજ ભાવાયેશમાં આવી પૂજયશ્રીને જેઠી  
પડ્યા. આ દર્શય રામ-ભરતના મિલાપ જેવું અદિતીય

હતું. બંને થોડો સમય લેટેલા જ રહ્યા. ત્યારબાદ  
સત્ત્રદેવજીએ અમને આશ્રમ બતાવ્યો. આશ્રમમાં રહેવા  
માટેની રૂમો સંપૂર્ણ સગવડવાળી હતી. નાનો સરખો  
બગીચો હતો. ગંગાજીના ઉનારે ઊંચાસા ઉપર આશ્રમ  
બાંધિલો છે. આશ્રમની સામે જ મહીકૂટ પર્વત આવેલો  
છે જે સિદ્ધો-તપસ્વીઓનો પર્વત રખાય છે.

આશ્રમ જોઈને પાછા આવ્યા. શ્રી સત્ત્રદેવજી વિષે  
પરિચય આપતાં પૂજયશ્રીને જ્યાંયું કે તેઓ પ્રખર  
વેદાન્તાચાર્ય છે, તેઓ જ્યારે પણ અહીં આવે છે ત્યારે  
વધુમાં વધુ સમય ધ્યાનમાં જ રહે છે, આટલા પરિચય  
બાદ સત્ત્રસંગ ચાલુ થયો. સત્ત્રદેવજીએ કહું કે સ્વામી  
દ્વારાનંદ સરસ્વતીને મહર્ષિ કે મહર્ષિ કહેવા તે કરતાં  
સમાજસુધારક કહેવા તે વધુ ઉચ્ચિત ગણાય. સ્વામી  
દ્વારાનંદ સંસ્કૃત વાકરણના પ્રખર જાણકાર હતા. તેમને  
તે જમાલામાં કોઈ ચેલેજ આપી શકે તેમ નહીંતું.  
સ્વામીજીએ સમાજસુધારનાં ધ્યાં કાર્યો કરેલાં. આ પ્રકારની  
થોડી વાતો કર્યા બાદ પૂજયશ્રીએ, નજીકમાં જીજા કોઈ  
સંત રહેતા હોય તો તેમનાં દર્શનની ઈચ્છા પ્રગત કરી.  
સત્ત્રદેવજી અમને આશ્રમની સામેના નિવાસસ્થાને લાવ્યા.  
સત્ત્રદેવજીએ નિવાસનું બારસું ખંડાવીને કહું કે, "શ્રીરામકૃપાલુગીરિજી, મેં આપકો એક બડે સંતસે મિલાના  
આદતા હું દરવાજા ખોલીએ." શ્રીરામકૃપાલુગીરિજીએ  
દરવાજો ખોલ્યો અને અમે અંદર ગયા.

શ્રીરામકૃપાલુગીરિજી વર્ષોથી તપશ્ચર્યા કરી રહ્યા  
છે. તેમના માથાની જટા ખૂબ જ લાંબી છે, પગની  
પાનીથી પણ બે-ગાંડ કૂટ લાંબી હશે. તેઓ પઢેલાં  
ગંગોત્રી રહેતા હતા. થોડાં વર્ષોથી અહીં જીવિકેશમાં  
સ્થાયી થયેલા. સ્વામીજીના ગુરુજી પૂરુષ શ્રી વિવેકાનંદજીએ  
ગૌમુખથી આગળ ચાલતાં ચાલતાં દેહવિલય કરી દીપિલો  
તેવું તેમણે જ્યાંયું. સ્વામીજી બજન ખૂબ સુંદર ગાય  
છે તેવું જ્યાંયું એટેલે અમારા સૌના આગ્રહથી સત્ત્રદેવજીએ  
સ્વામીજીને એક બજન ગાવા કહું. તેમણે હનુમાનજીની  
પ્રશંસા કરતું એક સુંદર બજન ગાયું. તેઓ હનુમાનલક્ષ્મી  
છે. સ્વામીજીના બજન બાદ અમે પ્રણવવંદના ગાઈ.

પ્રશ્નવંદના બાદ ગાયત્રીમંત્રનો અને સંકટમોચન મંત્રનો વાચિક જ્ઞાપ કર્યો. પવિત્ર વાતાવરણમાં બધા એકથિસે મંત્રજ્ઞપ કરતા હતા. ત્રણે સંતો એકભીજાને જાણે વર્ષો પછી મળ્યા લોય તેવા ભાવ સાથે વાતો કરતા હતા. મંત્રજ્ઞપ પત્યા બાદ પૂજયશ્રીએ મને પૂજ્યાં, “ શેખરભાઈ કેમ લાગે છે ? ” મેં કહ્યું, ‘ગુરુદેવ, ત્રણ સંતોના દર્શન કરી, ત્રિવેણીસંગમમાં નાદ્યાનો જે આનંદ મળે તેના કરતાં પણ વધુ આનંદ થાય છે. અહીંથી ખસવાનું બિલકુલ મન નથી થતું.’

રાતના અગિયાર થવા આવ્યા હતા. ઉઠતાં ઉઠતાં પૂજયશ્રીએ સત્રદેવજી અને રામકૃપાલુગીરિજીને આધ્યાત્મિક સાહિત્ય બેટ-પ્રસાદી રૂપે આપ્યું. સત્રદેવજીએ પૂજયશ્રી રચિત “મુક્તા” (પાતંજલ યોગદર્શન-સમાપ્તિપાદ) અને “શાંતા” (પાતંજલ યોગદર્શન-સાપનપાદ) પુસ્તકોની મંગળી કરી. પૂજયશ્રીએ તે બે પુસ્તકો પણ આપ્યાં. અમે સૌના આશર્વ વચ્ચે જોયું તો રિસાવાળા ભાઈ બહાર અમારી રાહ જોઈને ઉનેલા ! અમે અહો કલાકમાં પાછા આવીશું એમ કહેલું પરંતુ ખાસસા અદી

કલાક વીતી ગયેલા. આમ છતાં તેઓ અમારી રાહ જોતા ઊભા રઘા હતા ! કુદરત પણ કેવી અનુકૂળતા કરી આપે છે ! પૂજયશ્રીએ રિસાવાળાને “ ઓમ્ભુ ગુરુ ઓમ્ભુ ” લાભાક્ષાવાળા સ્ટોકરની પ્રસાદી આપ્યો. રિસામાં બેસી અમે સૌ પાછા આવ્યાં.

સત્રદેવજી મહારાજે ઉત્તરકાશી અને ગંગોત્રીમાં અમને તકલીફ ના પડે એટલા માટે તેમના પ્રેમી શ્રી રોશનલાલ શર્મા- કે જેઓ કાલી કમળીવાળા આશ્રમના સંચાલક-મંત્રજીમાં છે તેમને અમારી પાસે મોકલ્યા. તેમની પાસેથી ચિહ્ની લઈ, આભારસૂચક વાત કરી અમે ચૂઈ ગયા.

સવારે દશ વાગ્યે ઉત્તરકાશી જવા નીકળવાનું હતું. વહેલા ઉકી પ્રાતઃકર્મથી પરવારી અમે સૌએ સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાય કર્યા બાદ સામાન પેક કરીને ટેકીની રાહ જોતા બેઠા. ટેકી પણ સમયસર આવી ગઈ. બે ટેકીઓમાં બધી સામાન ગોહવીને અમે પણ ગોહવાયા. બરાબર અગિયાર વાગ્યે જ્રાહિકેશથી નીકળી અમે ઉત્તરકાશી તરફ પ્રયાણ કર્યું.

(કમશઃ)

## જ્ઞાન, યોગ અને ભક્તિ કોને કહેવાય ?

ચિત્તવૃત્તિઓનો નિરોધ કર્ય રીતે કરવો તેની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવી તે “જ્ઞાન”. તે જાણકારી-જ્ઞાન પ્રમાણે આચરણ-કિયા કરીને ચિત્તવૃત્તિનિરોધનું ફળ પ્રાપ્ત કરી લેવું તે “યોગ”. અને ચિત્તવૃત્તિનિરોધ-સુખમાં પ્રેમ થઈ જવો તે થઈ “ભક્તિ”.

જેમકે, લાડુ કર્ય રીતે બનાવવા તેની જાણકારી પ્રાપ્ત કરવી તે થયું જ્ઞાન. તે જ્ઞાન પ્રમાણે લાડુ બનાવીને જમીને તૃપુથવું તે યોગ. અને પછી એ લાડુમાં પ્રેમ થઈ જવાથી, લાડુભક્ત થઈ જવું તે થઈ ભક્તિ.

-યોગભિક્ષુ

## ઓ. પ્ર. પ. ટ્રસ્ટના પ્રકાશન

### ગુજરાતી

૧.	ગુરુમહિમા (પોગરહસ્પોણી ભરપૂર)	૫૫-૦૦
૨.	મુક્તા (પાતંજલ યોગદર્શન - સમાપ્તિપાદ) (બીજી આવૃત્તિ)	૩૬-૦૦
૩.	શાંતા (પાતંજલ યોગદર્શન - સાધનપાદ)	૨૨-૦૦
૪.	મારા ગુરુદેવ (જીવન અને સાધનાની અનુભૂતિ) (બીજી આવૃત્તિ)	૧૬-૦૦
૫.	ઈશરના ઓળખ (ઈશર કોને કહી શકાય ?) (ઓમ્ભ વિષેની સંપૂર્ણ માહિતી) (બીજી આવૃત્તિ)	૬-૦૦
૬.	મૈત્રી (વિશ્વાંતિનું પોગરહસ્પ)	-
૭.	પૂજયદ્રોમાં ઈશર-દર્શન (દક્ષિણ ભારત અને અમેરિકાનો યાત્રા-પ્રવાસ).	૪-૦૦
૮.	સત્સંગ-પરાગ	૨-૦૦
૯.	નિર્જર જરૂરી કો ગેબદ્ધી (વિશ્વઅશાંતિના અતિ ગુપ્ત કારણોની મૌલિક રજૂઆત)	૪-૦૦
૧૦.	ગુરુપુર્ણિમા	૩-૪૦
૧૧.	ઓમ્ભ-પરિવાર	૧-૦૦
૧૨.	ધ્યાન શા માટે ?	-
૧૩.	ધ્યાયાય (બીજી આવૃત્તિ )	૧૦-૦૦
૧૪.	મારે સમાજને બેઠો કરવો છે (બીજી આવૃત્તિ)	૮-૦૦
૧૫.	પ્રેરણાસિંહ (બીજી આવૃત્તિ)	૨૦-૦૦
૧૬.	પ્રેરણાપીપુર (શ્રી ગુરુમેમલિલુણા પ્રેરણાદાયી ફો)	૮-૦૦
૧૭.	કડવું અમૃત (બીજી આવૃત્તિ)	૧૦-૦૦
૧૮.	અજાયા રહસ્યોનું ઉદ્ઘાટન	૪-૦૦

### હિન્દી

૧.	નિર્જર જરા કો ગેબદ્ધી (વિશ્વઅશાંતિના અતિ ગુપ્ત કારણોની મૌલિક રજૂઆત)	૧૦-૦૦
૨.	ઈશરકી પહ્યાન (ઓમ્ભ વિષેની વિસ્તૃત માહિતી - પાતંજલ યોગદર્શન-સમાપ્તિપાદના સૂત્ર ૨૪ થી ૨૭)	૧૧-૦૦
૩.	કાત-ચિંતન (પૂ. યોગબીજુણ અને ઓ. પ્ર. પ. ટ્રસ્ટનો પરિચય)	૧૯-૦૦
૪.	મુક્તા (પાતંજલ યોગદર્શન - સમાપ્તિપાદ)	૫૫-૦૦

### ENGLISH

1.	Maitri (The Yoga-secret of Universal Peace)	2-50
2.	Streaming From The Invisible (The subtlest causes of world unrest)	7-00
3.	Easiest Is Realization (Articles)	5-00
* 4.	Why Meditation ?	-
5.	Yogabhikshu - An Introduction	5-00
6.	I Wish to Awaken Society	10-00
* 7.	છ્યાઈ રહેલ છે	

ओंकार का वो घटक (नाम) प्रणव/ओम् है।



(ठाकुरिंदर के द्वारा द्वारा लिखा)

- (२४) ब्रह्म, कर्म, कर्मचल और वासना जिसमें नहीं है तो वह पुरुषविद्वान्/वेत्तनविद्वान् ओंकार है।
- (२५) ओंकार संपूर्ण संस्कार है।
- (२६) ओंकार पूर्ववाल के गुरुओं के मी गुरु है और भाल की नवांदा थे (जन्म-हस्त से) जह है।
- (२७) ओंकार का नाम प्रणव/ओम् है।
- (२८) ओंकार के वित्तन स्वीकृत ओम् जब जप करना।
- (२९) वित्तन सहित जप करने से जन्मगते या जन्मनाम भाटे अस्त्रपत्रात्मक दोता है।

लिखना ज्ञ. चौधरी, १/१, लक्ष्मीगंगा, लखनऊ, उत्तरप्रदेश-२०८००१।

### ● द्रष्टव्यापक उद्देश्य :-

- (१) सर्वव्यापक परम भूक्तम् वेत्तन तत्त्व के लेनुं नाम प्रणव (ओम्-अ॒) छे तेनी प्रतीति अहुजनसमाजने करवावा ग्रथत्तन करवो। (२) 'योग'नो ग्रन्थार, ग्रन्थार अने आंशोधन करवावा ग्रथत्तन करवो। (३) 'अमाजनु' नीतिक धैरण्य उंचुं लाववा भाटे आध्यात्मिक ज्ञाननो आहित्य द्वारा ग्रन्थार अने ग्रन्थार करवानो ग्रथत्तन करवो। (४) आ उपरांत 'अहुजनहिताय-अहुजनमुण्डाय'ने लगतां कार्यो लेवां के कैणवण्णी, तण्णीणी भारवार वगेरे करवा भाटे ग्रथत्तन करवो।

**PRINTED BOOK**

Registrar of News Papers of India under Regd. No. 48770/90



આધ્યાત્મિક સ્થળ

ગુરુ દેવ શ્રી યોગબિક્ષુજી

To,

PRINTED & PUBLISHED BY :-

Dr. S. S. Bhikshu for  
AUMGURU PREMSAMARPANDHYANBHIKSHU PARIVAR TRUST  
1/A, Paladnagar Society, Naranpura, Ahmedabad - 380 013.  
Printed at : Kunal Offset, Ondhav, Ahmedabad.

Hon. Editor : Naishadh C. Vyas

{ (Reg. No. E/4416 Date 11-5-81)  
I.T.E.U.80-g(5) No. H. O.-III/33-163/92-93 Up to March 1995 }

Pin Code

--	--	--	--	--	--	--

લવાજમ દર : -

વાર્ષિક સભ્ય (ભારતમાં) રૂ. ૧૨-૦૦  
આણુવન સભ્ય " ૨૫૦-૦૦  
વાર્ષિક સભ્ય (પરદેશમાં) ૧૨ ડોલર  
આણુવન સભ્ય " ૨૫૦ ડોલર

\* લવાજમ મોકલવાનું સ્થળ \*

(૧) દૉ. સોભાભાઈ એ. પટેલ

૧/અ, પલિથનગર,  
સેન્ટ જેવિયર્સ હાઇસ્કૂલ રોડ,  
નાશિયુપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

(૨) નૈષધ્યભાઈ સ્ટી. વ્યાસ

"સ્વાત્રય"  
૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,  
મહેનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

\* સૂચના \*

(૧) લવાજમ ચેક દ્વારા અથવા મનીઓર્ડ દ્વારા "એન્. પ્રે. પ. ટૂસ્ટ" ના નામે  
મોકલવું. સાથે આપતું પૂરું નામ,  
સરનામું શુદ્ધ અક્ષરોમાં લખી મોકલવું.

(૨) ને સભ્યનાં રહેઠાણનાં સ્થળ ઘફલાયાં  
દોય તેમણે તેમના નવા રહેઠાણનું પૂરું  
સરનામું લખી મોકલવું નેથી વ્યવસ્થા-  
પક્કાને અંક મોકલવામાં સરળતા રહે.

(૩) "રૂતભરા" ને લગતો પત્રાંયવહાર  
નીચેના સરનામે ઠરવો.

નૈષધ્યભાઈ સ્ટી. વ્યાસ

"સ્વાત્રય"  
૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,  
મહેનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

પ. પુ. ગુરુ દેવ શ્રી યોગબિક્ષુજી સાથેનાં  
સંસ્મરણો તથા પ્રેરક પ્રસંગો આવકાયે છે.